

REGISTERED No. B. 156

श्री

जैनधर्म प्रकाश।

ये जीवेन् दयावयः सृष्टति यान् स्वद्योपि न थीमदः

थ्रांता ये न परोपकारकरणे हृष्टति ये याचिताः ।

स्वस्याः सत्स्वपि योनोदयमहाव्याधिप्रकोपेण ये

ते लोकोत्तरचारुचित्रचरिताः थ्रेष्टः कति सुर्नराः ॥

“जे ज्येन द्योपि द्यागु छे, जेने द्यन्यने भद्र स्वल्प पञ्च रप्त्य द्वरते नरी, जे परोपकार इत्यामां याक्ता नरी, जे धायना कर्मा सत्ता युक्ता थाय छे, पौवनना उद्यत्यपि भद्रान्यायिना प्रदाप थें सों पञ्च जे संदृश्य रहे छे; अत्रा देवितर आश्रयं क्षारी भनोडर अरिनवाणा वेड डुडाक ज भनुओं होय छे, अयोत् अह अय होय छे.”

सुखामुक्तावति.

पुस्तक २८ रु. पैक. संनत १९६६ शाके १८३८. अंक १० मे.

अग्रट इता.

श्री जैनधर्म प्रसारक सभा, भावनगर:

अनुक्रमणिका:

१	दयाव्यशतक (समर्थोऽहि)	२५५
२	ठिरेउ चौठ भाल मुद्राखेष्टु चिवान्त	२६८
३	बन्दराजना राख उपर्थी नीक्कोता सार	३०९
४	ठिरिय रवृप	३२९
५	विचार तेवुं परिखाम	३२३
६	अभद्रानाह आते भजेदा श्री संघनो भहन भेगावडा	३२५
७	निरूप	३३३

श्री “सत्स्वरी” छापानान्—भावनगर.

भूल्य रु. १) पैसेटेज रा. ०-४-० बेट चाये.

सभा तरष्यार हातमां तैयार थयेता अथेता.

- १ श्री कर्मचर्यवीक्षणिलागर जे. (पंच-६ हो कर्मचर्य तथा संस्कृत कर्मचर्य)
- २ श्री पंचाश्री वीक्षणिलागर
- ३ श्री परिशिष्ट पर्व, सर्वितर प्रस्तावना आये.
- ४ श्री प्रभेयस्तलकेऽप्य न्यायना लघु पशु इपयोगी अथ
- ५ श्री ज्ञानसार सीटी (श्री योगिनिज्यशु उपाध्याय इति ३२ अष्टक)
- ६ श्री धनपाणि पंचाश्री वीक्षणिलागर सीटी, अर्थ शुद्धता, तथा तीर्थोना कर्त्त्वा अर्थ शुद्धता.

हातमां छपाता अथेता.

- ७ श्री पडेग चरितम् (मागधी-अपूर्व अथ)
- ८ श्री कर्मपंचवी. श्री गलिनिज्यशु कृत वीक्षणिलागर
- ९ श्री शांतसुखारस, पं. गलिनिज्यशु लग्नि कृत वीक्षणिलागर
- १० श्री पार्वतीनाथ चरित, संस्कृत गवांध.
- ११ श्री आनन्दवनशुना ५० पहो. विवेचन शुद्धता.
- १२ श्री कुरुत्रयमाणा भाष्यांतर (अल्पत रसीड क्षया)
- १३ श्री प्रकरण्ण निर्गोरना स्त्रवनाहिनो संबंध (वीजु आवृत्ति)
- १४ श्री तत्त्व वार्ता अनेकदीनीस्त्रवनीतो वाचा (आहडोने लेट आपत्ति माटे)
(तैयार थयेता अथेता.)

- १५ श्री अध्यात्मसार वीक्षण, पं. गलिनिज्यशु-कृत.
- १६ श्री अध्यात्मसार सीटीतुं लापांतर.
- १७ श्री उपांत्ति प्राचादाना ६ स्थल भूग.

(तैयार थता अथेता.)


- १८ श्री उपग्रहगतप्रथां इथ तु लापांतर.
- १९ श्री देवताद्वयार्थ चरित.
- २० श्री परिशिष्ट एवं लापांतर.

२० पर अल्पवेता प्रथगता छ अथेता चैकी कर्मचर्य लिलागर जे अने प्रभेयस्तलकेऽप्य तथा धनपाणि पंचाश्री वीक्षणिलागर, परेक्व छे. जाईना लालू अथेता पशु तैयार थर्ग गया छे. इतन यात्रीत्वा यथा गाए अने अंधावदा गाए यांशीमां छे. ७-८-११. नगरवासां अथेता डामपशु गृहस्थानी सदाव शिवाय छपावदा भाइव छे. ज्ञानदान हेवाना इच्छक उदार दिलवाणा गुरुदर्शको इच्छा अल्पवेता आवा तैयार अथेता गगवा मुर्देव छे; अने शुद्ध करीने छपाता आपावतुं पशु तेटहुँ अ सुरुदेव छे.

आहडोने सूचना.

तत्त्ववार्ता अनेकदीनीस्त्रवनीतो संवादवाणी शुद्ध छपाईने तैयार थयो अहट्टो ते अने धनपाणि पंचाश्री वीक्षणिलागर ने शुके लेट तरीडे गोडलवामां आवैता आवैतानी लेट गाए पशु अंडा अल्पत रसिड शुद्ध तैयार थाय छे. प्रथगतप्रथां लांडेक इक्षुन.

श्री जैन धर्म प्रकाश.



तत्र च गृहस्थैः सज्जिः परिर्द्वित्योऽकव्याणमित्रयोगः, सेवितव्यानि
कव्याणमित्राणि, न क्षम्भुनीयोचितस्यिति:, अपेक्षितव्यो द्वोक्तमार्गः, मान-
वीप्राप्तिसंविति: —

अत्यंत ऐदकारक भनाव.

शेठ भनसुभलाई भगुभाईनो स्वर्गवास.

आगदावादना श्री संघमां आगेवान ऐटलुंज नडी पश्च आगा
हिंदुस्थानना श्रावक समुदायमां एक अमूल्य ज्वालीर समान शेठ
भनसुभलाई छेवटनी श्री संघनी सेवा धन्दनीने गया भागशर वहि
१२ शनिवारनी रात्रीना ६ क्लाउ भाव वश्च दिवसना न्वरनाव्याधिमां
ऐक्येक पञ्चत्वने पास्या छे. ऐमना आकस्मिक मरब्द्युथी जे पार-
वार ऐद आगा संघ समुदायमां उत्पन्न थयो छे ते हुङ्कामां धतावी
शकाय तेम नभी. तेहो अमारी सलाना पेटन हता जेथी सलाने पश्च
न गुरी शकाय तेनी आभी आवी पडी छे. आ संघमां विशेष हुङ्क-
कत तेहो. सलेणना होइा साथे आवता अङ्कमां लभवानी होवावी
अत्रे गाव दिवगिरीनी मेंधज लेवामां आये छे. अमे तेमना लघु
बंधन ज्वरनाभाई शेडो तेगज ची. बहुभाई ने भाकुभाई निजेइने
अमारी अंतःकरणानी दिवगिरी हश्चिवना साथे हिलासा. आपीछे छीमे
अने परमात्मा तेमना आत्माने शांतिसुख आप्या ऐमर्हच्छीमे छीमे.

सारो वतन वंशु इवपतत् न, छे डेअप आम्भेम्भं;
संतोष सरण्यो न भिन वगमां, ने लोक रिपु हर,
‘सादृं ने नरसुं’ अताव्युं, पशु तुं धन्या प्रमाणे कृ! ६१


सभा तरष्यथी हातमां तैयार थयेलां अथे।

- १ श्री कर्मचारीका विभाग र.ल. (पर्याप्त हुए कर्मचार्य तथा संस्कृत कर्मचार्य),
- २ श्री पर्याप्त, दीडा सहीन,
- ३ श्री परिषिष्ठ पर्याप्त, सविस्तर प्रस्तावना साधे,
- ४ श्री प्रगेयरत्नके.प. न्यायना लघु खलू उपयोगी, अथ.
- ५ श्री ज्ञानमार सरीक (श्री बधौविज्ञयतु उपाध्याय कुल ३२ शिष्टक)
- ६ श्री धनपाल पर्याप्तिका सरीक, गर्व सुक्ता, नक्षा तीर्थोना कठोरो अर्थ सुक्ता

आदेकोने सूचना।

तरथवाती अने लक्ष्मी चरस्तीना संबाददाणी युक्त इपाईते तैयार घरे छोट्हो ते अने धनपाल पर्याप्तिका अने युक्ते लेट तरीके मोडलचारी आवश्यो, आगाजीनी लेट भाटे पछु एक अल्पत रसिद युक्त तैयार थाय छे, प्रसंगोगात् घाँडर करक्कु

श्री जैन धर्म प्रकाश.



तत्र च गृहस्थैः सज्जिः परिहृतव्योऽकव्याणमित्रयोगः, सेवितव्यानि कव्याणमित्राणि, न बद्धनीयोचितस्थितिः, अपेक्षितव्यो द्वोकर्मार्गः, माननीयः गुरुसंहतिः, जवितव्यमेतत्तंत्रैः, प्रवर्तितव्यं दानादौ, कर्तव्योदारपूजा नगवतां, निरूपणीयः सायुक्तिशेषः, श्रोतव्यं विधिना धर्मशास्त्रं, ज्ञावनीयं महायत्नेन, अनुष्टुप्यस्त्रादर्थो विधानेन, अवद्वाम्बनीयं धैर्यं, पर्यावोचनयायतिः, अवद्वोकनीयो मृत्युः, जवितव्यं परद्वोकप्रधानैः, सेवितव्यो गुरुजनः, कर्तव्यं योगपट्टदर्शनं, स्थापनीयं तद्रूपादि मानसे, निरूपयितव्या धारणा, परिहृतव्यो विक्रेपमार्गः, प्रयतितव्यं योगशुद्धौ, कारवितव्यं नगवद्नुवनविम्बादिकं, लेखनीयं ज्ञुवेनशब्दनं, कर्तव्यो मझद्वजपः, प्रतिपत्तव्यं चतुःशरणं, गर्हितव्यानि छुक्तानि, अनुमोदयितव्यं कुशब्दं, पूजनीया मंत्रदेवताः, श्रोतव्यानि सञ्चितानि, ज्ञावनीयमौदार्यं, दर्चितव्यमुत्तमङ्गोत्तम, ततो जविष्यति ज्ञवतां सायुथमानुष्ठानज्ञनता ॥

उपमितिज्ञवप्रपञ्चा कथा.

पुस्तक ५६ भुं.

पैथ. सं. १९३६. शाढे १९४४.

अंक १० शे.

ॐ अँ हूं नमस्तत्त्वज्ञाय.

वैराग्य शतक.

समश्लोकी.

(लेखक-भावल दम्पत्ति शाह.)

(अनुसंधान यृषि २६३ थी.)

‘ठारूङ्यसरखु’ सुधारस नहिं, ने द्रेहनेतु’ विष,
सारां वर्तन केवुँ ठव्यतइ ने, छे डेअ अभिभिष;
संतोष सरभो न भिन जगमां, ने लोल रिपु हर,
‘साइ’ ने नरचुँ’ थाताव्युँ, परु तुँ धम्हा भ्रमाव्युँ कर ! ६१

२५६

निनाम ग्रन्थ.

એचિત્યરૂપો હિંદુ વલ્લ ધરતી ! શીલાંગ રંગેન્નથી,
અદ્વા-દ્વાન-વિચેક ભૂપણું, ગળે કાર્યમાળા છની;
સદ્ગ્રોધાંજન આંલુ રંજન કરે, ચારિન પગાંકુર,
ને નિર્વાણ તું ઈચ્છતું હિંદુ ! તો ! ક્ષાંતિપ્રિયાને રમર. ૬૨

જ્યાં ખીઠ ન મતિઅમ, નહિ રતિ જ્યાંતિ નહિ ઉચ્ચતિ,
કે વ્યાધિ, નહિ લક્ષ્મી કે નહિ વધ, ન ધ્યાન કે ન સ્મૃતિ;
ને ને હાસપણું, વિલાસવદન, ને હાસ્ય નહિ લાસ્ય રે !
તે સાંસારિક પુન્ય-પાય નહિ જ્યાં એ સ્થાન છે ધ્યેય રે. ૬૩

હીંદુ ત્યાસુધી સૂર્યનાંજ કિરણો ! યશેશર ચર્ચાવાન. (!)
સંપૂર્ણું હુસ્ખી પ્રિયા ! પ્રિયમણી ! માર્દુર્ય છે રસ્ય આઓ (!)

૬૪*

આયો-^{હુંદુથે,}
મંત્ર રહસ્ય વિચક્ષણું ! મંત્રીસમ દ્વાર લાગને ચોણ્ય ! ૬૫

ચોચો ધર્મ ગરે ! પ્રમાદવશથી માનુષ્ય પાર્નો અને,
સાધ્યા, લક્ષ્મી છતાં નહિ હૃપણું થઈ, એ ચર્ચી ને કામને;
અત્યારે ચલ ચિંતા, નિયાં કરે ! તોએ મળે ના મળે,
રે ! રે ! શાસ્ત્રત ને પ્રસાદગૃહ ! એ મુદ્દિતા, અતિ દ્વાર છે. ૬૬

આકાશો પણ ચિંતર રે ! કણ શ૊લા એ મંત્ર કે તંત્રથી,
બંને હુથ થી રે ! સસુદ્ર તરીથે ! અદ્વાની પ્રાસાહીથી;
હેણાચે અહુદોગથી ગંગનમાં તારા પ્રભાતે સ્કુટ,
દ્વિસામાં ઠઢી એ નહિ નિયમથી ઠવયાણનો ગંધજ. ૬૭

* ૨૫૬ાં ગુડુલ ભાગ મુજબચ્યમાં જ નથી.

વેદાંગ શાસ્ત્ર.

૪૫

**આનુષ્કૃપુ-રાવિચ્છાનું દિનોનું એ ! તેમ જયેતિ ! વિભૂષણું !
સતીયેને ! યતીયેને ! તેમ ઘ્રણ અખાંડિત.**

૬૮

**આનુષ્કૃપુ-માયાએ શોભતી વેશયા, કુલકન્યા ! સુશીલથી !
સ્થાયથી રાજ્યતો રાજી, સદાચારવડે સુનિં.**

૬૯

જ્યાંસુધી, હુઃખની અરે ! વિધુરતા ! એ અંગ સેવે નહિ,
ને એ ધન્દિયનું પદૃત-હરતી, કૂરા-જરા રાક્ષસો;
ત્યાંએ, નિષ્કલ-નિશ્વલ સુપદ ને, કર્મક્ષતિ કારણે,
ધ્યાન ! ધ્યાન વિચક્ષણે, સ્કુટપણે, એ ચિત્ત પદ્મોદરે. ૭૦

અજ્ઞાનાવૃત ચિત્તથી ! પણ અરે ! મહારાં અતિ મૂહુરત,
રે ! રે ! ધર્મરૂપી ધન ! હરિ લીધું ! એ કાશીના ધૂર્તવત;
તો આ ચોચય કર્યું ! અરે પણ થશે સારું હુંયે સત્ત્વર,
પુન્યે મેં ગુરુની કૃપા લોધી હુંયે ! છેડી અને જ હૂર. ૭૧

તે'નું નાગપાતેનું નાગવધુનાં સોગોપચારે નહિ,
તે'નું વેસન ડે વિલાસ ણહુંએ તો શિવનું રે ! નહિ;
તે'નું વળિનુંએ ન હેવવનિતા, ના, સંગથી રે થતું,
જેણું રે ! સુખ ! વીતકામ ગુનિને ! સમ્યક પ્રકારે થતું. ૭૨

**આનુષ્કૃપુ-પાતળા ઉદરે નાર, તપથી હુંણો સુનિ;
પાતળા સુણથી ગાઢ્ય, શોહો ! આભૂષણું નહિ.**

૭૩

ગોલાવ્યો ! શુવતિ ઓંએ ! પ્રિયવચે ! પ્રેમાળ દિલ્લિને,
કોષે નેત્ર સુરક્ષત, એ થધ ગયાં ! જ્ઞાવાય એ ચક્ષુએ;
સદ્ગ્યાપારથી તિલમાત્ર પણ ને, સંકોલ પણે ન હૈ !
રણદ્રોષ રહિત ડોઈ જગમાં ચોરીંડ્ર એચો હુંયો. ૭૪

અપૂર્વ.

મૂળ મુખ્ય મુદ્રાલેખો.

MOTTOS.

(લેખક-સાનિત કાર્યરવિજયજી.)

- I Remember always that labour is one of the conditions of our existence.
- II Time is gold. Throw not one minute away, but place each one to account.
- III Do unto all men as you would be done by.
- IV Never put off till to morrow what can be done today.
- V Never bid another do what you can do yourself.
- VI Never cover what is not your own.
- VII Never think any matter so trifling as not to deserve notice.
- VIII Never give out what does not come in.
- IX Do not spend but produce.
- X Let the greatest order regulate the actions of your life.
- XI Study in your course of life to do the greatest amount of good.
- XII Deprive yourself of nothing that is necessary to your comfort, but live in honourable simplicity and frugality.
- XIII Labour then to the last moment of your existence.
- XIV Patience & Perserverance overcome mountains.

ઇંગ્રેજી ચૌદુ ભાષા મુદ્રાલેખોનું વિવેચન.

‘સહૃદિયમ.’

૧ ‘સહાય સ્વરથુભાં રાખો કે ઉદ્યોગ એ આપણા જીવનની એક ખારા આખીયત છે એટલે આપણે તે વગર રહી શકિયેન નહિ. ’

યત:—આલસ્યં હિ મનુષ્યાણાં, શરીરસ્થો મદારિપુ: ।

નાસ્ત્યુદ્યમસમો વંનુ:; કૃત્વા યત્નાવસીર્વતિ ॥

ઇંગ્રેજ ચૈદ મહા સુદ્ર લેખણું વિવચન.

૨૬૬

અધ્યાત્મ આળાજ-નિર્દ્યમીપણું એ શરીરમાં છુંગાઈ રહેલો મનુષ્યોનો એક મહોદો શરુ છે, તેનાથીજ સંઘણ સુંદર કામ વિલુસે છે. ત્યારે ઉદ્યમ-કોઈ પણ શુભ કાર્ય પછવાડે તન મનથો મન્યા રહેવાની ટેવ-એ એક બાંધુરામાન માણસું જતને સહાયકારી છે-એ કોઈ તેનું દફ આલંખન થણે છે, તેને કયાંય સીદાવું પડતું નથી, પણ તેના કાર્યની અંતે ચિદ્રિજ થાય છે.

ઉક્તવચન આશ્રી જાણો આદોચ કરનાર માનવી ધારે તો તે એક કૂર હૃદમનની ગરબ સારનાર આળાને તહેન અણણું કરી નાણી કોઈ પણ પ્રકારના ચાહુંગનાં રોપાનું આપું જીવન સુધારી શકે એવા ના.

‘અમૂલ્ય વણત.’

‘વખત એ સુવર્ણ લેવો ખાનુ મૂલ્યવાળો યા અમૂલ્ય છે. એમ મનમાં સમજ રાણી એક ક્ષણુ પણ નકારો કરવા હેઠો નહિ. પણ દરેક ક્ષણનો હી-સાધ ગણ્યો તેને લેજે કરને-સાર્થક કરી લેજે. ’

યતઃ “ અજરામસ્વતુ પ્રાજ્ઞો, વિદ્યાર્મ્ય ચ ચિન્તયેત् ।

ગૃહીત ઇવ કેશેષુ, મૃત્યુના ધર્મમાચરેત् ॥

અધ્યાત્મ યુદ્ધિશાળી પુરુષે જાણે પોતે અજરામસ-શાસ્ત્ર-સ્થાયીજ રહેવાનો હોય તેમ સમજુ (પ્રમાણિકપણે) વિદ્યા અને અર્થને ઉપાર્જન્વા થતન કરવો જેધાંશે, પણ એહી-આળસુ થઈને તેની ઉપેક્ષા કરી બેસી ન રહેવું જેધાંશે. તે સાચે એ પણ લક્ષ્યમાં રાણું જરૂરનું છે કે જાણે પોતાને કાળ-કૃતાન્તે જરૂરિયા આવીને પકડી લીધો હોય તેમ અલ્યાંત લુગરથી ધર્મ (સ્વર્ગતન) તું શરણુ જલ્દી લાલી કેવું જેધાંશે. મતલાળ કે ધર્મના ઉત્તમ નિયમોને દફપણે, વળણી રહી તેમાં લગારે વિરોધ ન આવે તેમ વિદ્યા અને ગર્યાદિ કામના સિદ્ધ કરવા યથાયેચ્ય ઉદ્યમ કર્યા કરવો જેધાંશે. એમ વર્તવાથી ગમે એટલા લાંબા જીવનમાં પણ કંટાળો આવશે નહિ; પરંતુ એક લક્ષસહિત સ્વ સ્વ ઉચ્ચિત કાર્ય પાઠળ મન્યા રહેવાથી મજામાં વણતનો વ્યય થવા સાથે સ્વધષ્ટ કાર્ય સિદ્ધ થતાં માનવસતની પણ સર્જણતા થશે.

‘શાહલ ઈન્સાઝે’

અંગેવું શુશે કે શુદ્ધ વર્તન સામા થડી તમે ઇંછો એવુંં ઉત્તમ વર્તન તમે તેમાં પ્રથે રાણો? જે તમે અદલ ઈન્સાઝેને ચાહેતા હો તો તમે લગારે સાંચાર રાખ્યા વગર બીજી સર્વને અદલ ઈન્સાઝ આપતાજ રહ્યા. જે તમે કેવળ સુખનીજ ચાહેતા હો, હુંખને નજ ચાહેતા હો તો સહુ

डोँहने सुअ-थानि उपरे—डोँहने हुःण—अथानि नज उपरे अम काणाळुरी वर्तो ! ऐवुं शुभाशुभ वर्तन तरो धीन तरक चतावयो तेबुंज शुभाशुभ वर्तन प्रायः तेम्हा तमारा तरक चताववा लक्ष्याये. गतदण के तमादृं लाविय सुधारबुं अ तमाराज हाथमां छे, अटलुंज नहि पशु धीन णधारेन्हुं हित करवा आहो तो ते तमारा सद्वर्तनवडे डरी शडे अम हे—अमन अमे. उत्तम उपाय छे.

यतः—“ श्रुयतां धर्म सर्वसं, श्रुत्वा चेवावगार्यताम् ।
आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरेत् ॥ ”

अर्थात् धर्मना रहुरयभूत उत्तम इरमान अराणर ठान हठने आपणे सांख्यावां, सांखणेकां उत्तम इरमान हृदयमां धारी लेवां; ते अंड इरमान विभवी न ज्वां; पशु विवेकपूर्वक ते पवित्र इरमान सुज्ञा अचायरयु करबुं अटवे के वात आपणु आत्माने अहितकारी—अनर्थकारी—अद्योगतिमां लक्ष जनारी—ज्ञाय ते ते वातेना अगतरा धीन डोँह उपर अजमाववा नहि. मतलक उके वात आपणुने पेताने नुकशनकारी, गोटी, अन्याय लरेवी अने अद्योगतिमां घसडी लक्ष जनारी छेवाथी नहि करवा येण्य ज्ञाय ते ते हिंसा, अन्यत्य, अदृत, अभद्र प्रभुण पाप स्थानको आपणे लते सर्व शक्तिशी वर्णने—अस्तमसंघम सेवी धीन आपणा भानव बोधयो पशु ते ते अनिष्ट पाप-स्थानकोथी भवया पामे तेम तेमां पशु यथाशक्त उपहेशाहिकवडे अहुकृणता दरी आपवी अ आपणा पवित्र इरज छे, अटलुंज नहि परंतु तेम उत्तां मार्गमां ले डोँह प्रतिकृणता आही आवती छेय तेने स्व रामर्थवडे हूर करवा चूक्लुं नहि, अपण आपणुं उत्तम ईरव्यव छे अम आपणे अण्ड लान राणी रेहेवुं जेहजे. तो पढी धीनेनामा मार्गमां प्रतिकृणता खडी करवानुं तो रहुंज क्यां ? स्वहितने अरेखर हृष्टहाता अने यमनता कुज जन्मा क्षापि क्षणे पशु अन्यजनेना मार्गमां आहणीव नांगे अ नहि अनवा जेग छे. तेम छतां ले जन्मा पेतानी विषम वृत्तिशी अन्यजनेने प्रतिकृण थई वर्ते छे ते आपडा मुऱ्य ज्ञोये इत्यु अरो हितमे मार्ग बळयो के आहयेन नथी अम सिद्ध थाय छे. अस ज्ञानी अने विवेकीतुं तो शास्त्रकारे आवी दीते व्याख्यान करेवुं छे के—

“ मातृवत् परदारेषु, परद्रव्येषु लोष्टवत् ।
आत्मवत् सर्व भूतेषु, यः पश्यति स पश्यति ॥ ”
(६) परस्त्री विषे भाता जेवी शुद्धि राणे छे, पर द्रव्य विषे पश्यर जेवी शुद्धि

શુદ્ધેજ યોગ માટા સુદા લેણોતું વિવેચન.

૩૦૨

રાજે છે અને સર્વ લુચ-જાતુઓને પોતાના પ્રાણુસમાન લેણે એ નેજ ખરો કાણી-વિવેકબંત છે, એમ સરાને. ભતવણ કે ખરા શાખા તેમનેજ લેણવા જોઈએ તે ને જરૂરોને પોતાની જતની-માતાની એવેજ પૂર્ણ યુદ્ધિથી અંગરી ડોઈ પણું પરાઈ શીંને ક્રેણે છે-તેના તરફ ગમે તેવે પ્રસંગે પણું કશી કુણુદ્વિ નહિ કરતાં પોતાની માતાજ જાળે તે હોય તેમ વર્તી છે. કેવી રીતે માર્ગિમાં પડેકા પથપરની ઉપેક્ષા કરી સહુ ડોઈ સંલાણ રાણી સહુ સહુના માર્ગે સંચરે છે તેમ શાયા-નાતિ-માન સંદગૃહસ્થો પણું પર દ્રવ્યને પથથર સમાન ઉપેક્ષા પાવ ગણી તેની કથી તમા રાણતા નથી. ચયાપ્રાપ્તમાં તેઓ સંતોષ ધારી રહે છે, અને અનીતિથી પ્રાપ્ત થતા પરાયા દ્રવ્યને કેવળ અનર્થદ્રઘ સમજે છે, કેવી તેનો સંદંતર પરિહાર કરે છે. વળી સર્વ લુચેને સુધ્ર હુંઘની લાગણી સરણી હોય છે, એમ સમજું સહુ ડોઈને આત્મસમાન લેણી ડોઈ લુચને ડોઈ રીતે પરિતાપ ન ઉપને એવી શુભ પ્રવૃત્તિ અર્જૂન પુરુષો સ્વતઃ કરે છે. તેઓ સહુના લલામાંજ રાજુ હોય છે, કદાપિ ડોઈના પણું ખૂસમાં રાજુ હોતા જ નથી. આવા ઉત્તમ પુરુષોતું જ જાયપથું લેણે છે. આદી તથા પ્રકારની રહેણી-કરણી વગરની કેવળ કુણી કથની તો ગમે તેટલી કરવામાં આવે તેથી કંઈ પણું તત્ત્વથી હિત થવું સંભવતું નથી. એમ સમજુને આપણું સહુ ડોઈએ કેમ સ્વપર હિત સિદ્ધ થય તેમ વર્તવા કાળજી રાણી તેવીજ ઉત્તમ રહેણી-કરણી આદરવી અતિ આવશ્યક છે.

‘કાર્યાંગુ.’

૪ ‘જે કંઈ કરવા ચોય કાર્ય આજે જ કરી શકાય ચોલું હોય તે કદાપિ પણું કાલ ઉપર છોડી હેતા નહિ.’ કારણું કે જે કાર્ય આપણે ધાર્થિ તો ખુશીથી આજે જ આદરી પાર મૂઢી શકાય, તેને કાલ ઉપર કરવાનું રાણી મૂકુવામાં આવે છે તો પ્રાય: તે કાર્ય વિલંબથી કરવા જતાં ડેઈક વિધને આવીને ખડા થાય છે, અને તે વિધનોના વૃદ્ધને હડાવવા જતાં મૂળણું કાર્ય વધારેને વધારે વિલંબમાં પડતું જાય છે અને એવા અનિષ્ટ સચેતો મળતાં કદાચ મનમાં કરવા ધારેણું કાર્ય સમૂહણું રહી જ જાય છે, અને પોતે પહુલે જ દ્વિસે તે કાર્ય પ્રમાદ તળુને કેમ ન કર્યું? તે વાત વારંવાર ચાદ કરીને પર્યાતાપ જ કરવાનો રહે છે. એમ સમજું એયકારી કાર્ય કરવાનો મનોરથ થતાંજ તેને ચિદ્ધ કરી લેવા મળેલી અમૃત્ય તક કદાપિ નહિ શુભાવી હેતાં તેને કેમ બને તેમ જલી હાથ ધરવી જ ઉચિત છે, કંદું પણું છે કે:—

“ એયાંસિ વહુ વિવાનિ, પ્રાયશો મહ્તામપિ ।

અશ્રેયસિ પ્રદૃજાનાં, કવા પિ યાન્તિ વિનાયકાઃ ॥ ”

आर्थित् श्रेयकाम इत्यां महान् पुरुषोन्म पशु प्रायः वाणां विज्ञा नडे छे. अतो नणां कार्यं करनारं इवित्तिज्ज विष्ट नडे छे. उगडे नणां कार्यं ज्ञेन विज्ञान् छे, असे अधिगति ज्ञानाणांगेनेज ग्रायः तेवां नणां कास इत्यां सूक्ष्मे छे. ए नणां कार्यं करने तेथी धनारी अधिगतिने अवस्थ आमचा निर्भय थयेदुङ्ज होय तो ते कार्यं क्षयविगर रहेणातुंज नथी. त्यारे श्रेयकाम तो ग्रायः चद्यगतिगामी सञ्जनेनेज इत्युं सूक्ष्मे छे. तेवां श्रेयकार्यं सिद्ध इत्यां तेमने काई ने काई क्षेत्रीमांथी पसार थवुं पडे छे. परंतु के पुन्यवंत ग्राहींगा दृढ टेक्काणा अने कार्यदक्ष होय छे ते ज्ञानधानपशु स्वर्णर्थं निहिते प्रयत्न कार्यों करे छे. विज्ञेयां ते काई ही ज्ञान नथी. अयता नयर ज्ञेनी पैरे तेच्चा आगणारी विज्ञेयी संबावना करीने कार्यं करनामा ग्यायिका सेवता नथी; परंतु उत्साहेवर आदेश्ला उवित्त कार्यने यार मुकुवा जानतुं करे छे. भवतवण के तेच्चा नक्षेमा विलंभ क्षयविगर स्वर्णर्थ कार्यमां प्रवृत्ति करे छे, अने धारेदी बुराह पार पाडवा देके प्रयत्न सेवे छे. एवा पुरुषोन्म अदैगर कार्य-दक्ष होइ स्वर्णर्थ कार्यं सांप्ती शके छे. ए वात निर्यतुप नणीने आपणे पशु कोई पशु हिंत कार्यमां हीर्घसूवीमधुं-अंती-आणसुपशुं निहित इत्यां शीघ्र स्वर्णर्थ कार्यमां प्रवृत्ति करी ते आदेश्ला कार्यमां थदा अने दिग्भतथी मच्चा रहेणुं नेहुंच्च. एज आपणुं असीष्ट कार्यं सिद्ध करनामो उत्तम उपाय छे.

‘ज्ञानवर्मणेनतं.’

५ “ने कार्यं तमे ज्ञाने-ज्ञानवर्मणेनतथीकरी शको ते इत्या धीन्नने भावावता नहिं.” “बृहस्पति दधिध्यासः” नीति शास्त्रकार बृहस्पति कहे छे के डोळानी विद्यास राखता नहिं-डोळाना लाढ़से रहेता नहिं. वजी कछुं छे के:—

“परशी आशा सदा निराशा, ए हे जगज्जन पासा;

ए काठनकुं करो अक्षयासा, लडो सदा सुख वासा, आप स्वलाव०”

भवतवण के पारदी आशा राणी ऐच्ची रहेतां परिणाम ग्रायः निराशामां ज्ञाने के सारे स्वाश्रय-आत्मग्राह किपर उत्ता रहेतां परिणाम आशाज्ञनक आवे छे. तेथीनं स्वासुखवी ज्ञेना अभ्युप्रवृत्ति उपहेश आपे छे के आत्मग्राह उपदेश अधिक निधास राणी. कछुं छे के ‘आप समान वजा नहिं अने शेष समान वजा नहिं’ तेथी पशु एज स्पष्ट थाय छे. आत्मामां अनंत शक्ति लादेदी छे तेने समान तेगां विद्यास राणी वेम ज्ञाने तेम अंतमुण्ड गातो. परसुभप्रेक्षी यद्य कायरता न धरो, लेम लेग स्वकर्तव्यमां कायरता-

શિથિલતા સેવણો, તેમ તેમ તમારા ફુર્લક્ષયી તમે હુંણી થણો, અને કેમ કેમ ધ્રયરત્તા તળ સ્વર્કર્તવ્ય કર્મમાં સાવધાનતા રાખણો તેમ તેમ અપ્રમાદ અથવા કૃતવ્ય-પરાયાસુતાથી તમે સુણી થતા જણો. બસ એથી એટલું ચોક્કસ સમજું રાખવાનું છે કે આપણે અવસ્થ કરવા ચોણ કાર્ય કરવામાં આપણસ-પ્રમાદ નહિં. સેવતાં, તે માટે ધીનના સુખ સામે જોઈ નહિં રહેતાં, બની શકે તેટલા પ્રમાણમાં જરૂર આત્મભાગનો ઉપયોગ કરતાં રહેલું. પણ એ ઉપરથી એમ સિદ્ધ નથી થતું કે કોઈ પણ રથને કોઈ બાળતમાં કોઠના પણ વિશ્વાસ રાખવો નહિં. એમ માનવાથી તો કેટલીક ખાસ જરૂરની બાળતોમાં અન્ય અધિકારી જનોની આમૂહ્ય સહાયની કે અપ્રેક્ષા રહે છે તે વ્યવહારનો ઉચ્છેદ થઈ બય એટલે કેટલીક અશિક્ષિત બાળતોમાં સુશિક્ષિત જનોની સહાય કેવાની શરૂઆતમાં જરૂર રહે છે જ તે પણ કહેવામાત્ર થઈ જય. એટલે ખાસ જરૂરી બાળ-તોમાં શિષ્ટ વચ્ચનાસુસારે ધીન ચોણ જનોની સહાય-સલાહ કેવી પણ ખરી, અને તે પણ વિશ્વાસપૂર્વક જ. પરંતુ સર્વ બાળતમાં એહી-આપણું બની, પ્રમાણે પોતાવો તો નહિંજ.

‘ સંતોષ વૃત્તિ.’

૬ ‘ કે તમાડું પોતાનું નથી તેની તૃપ્તિ કદાપિ કરણો નહિં.’ જેના અંતર ધરમાં વિવેકદીપક પ્રગટયો છે તે સત્યાસત્ય, લાલાદાલ, હિતાહિત અને ફુલાફુલ્ય જાળી-જોઈ શકે છે. કેથી તે માડા માર્ગને તળ સત્ય-કૃતી માર્ગને આદરી શકે છે. એ રીતે વિવેક દૃષ્ટિથી વસ્તુ સ્વરૂપનો નિર્ધાર કરી જે ઢૂઢી રહેણી-કરણી પણે છે તેનું ખરા જ્ઞાની અને ચાસ્તિપાત્ર છે. ત્યારે એથી ઉલદું વર્તન કર્ણનાર બાપડા છતી આંખો આંખળા કેવા આંખળાજ છે. કેમકે તે અવળા વિપમ માર્ગે ચાદ્રી એવા ઉંડા ખાડામાં ગળાડી પડે છે કે જેમાં તે પોતાની સ્વચ્છાંદ વૃત્તિથી માયઃ અનંત કાળ પર્યાત અતિ કડકાં હુંઘ-નેર ગતુલબ્યાં કરે છે. આવાં અનિવાર્ય અનંત હુંઘથી બયવા માટેજ જ્ઞાની પુરુષો પોતે ઉત્તમ રહેણી-કરણી આદરી તેનો રસાસ્વાદ મેળવી, ચાવતું તેથી એકાંત લાલ જાળી બાપણને સન્માર્ગે સાંચરવા ભાર દઈને ઉપદ્ધિશો છે, અને અનીનિના હુંઘદાયક માર્ગથી સહંતર ફર રહેવા આશ્રદ કરે છે. એ હિતે-પદેશ હુંધે ધરીને કે કોઈ આત્મહિત્યા ભાઈ જ્ઞાનો ઉન્માર્ગના પરિહાર કરી જન્માર્ગના સ્વીકાર કરે છે તે આ કોડમાં તેમજ પર કોડમાં સર્વત્ર સુણીજ થાય છે. અને કે હુંઘાફૂરા સુંઘ જનો અંતવાનાં જળ કેવાં ખોટાં, ક્ષાણિક, અને અસાર એવા ફલિપત સુખમાં લલચાઈ નિઃસ્વાર્થી જ્ઞાની પુરુષોએ

३०४

नेत्रभै प्रकाश.

क्षीरेवी सत्यी, हितार्थी, सारस्वत शिखामण्डुने अवगत्यी आपमनेज, आवे
छे ते बापडा भासर ज्ञाने शिष्ट ज्ञानेचे सेवेका याम मार्गनो त्याग करी,
हृष्टिगामी, हृष्ट ज्ञानेचे सेवेका विषम भार्गनेज मळमपणे वणांगी, रडे,
वायी पोतानी मार्गी करण्यावडे उलाय लोडगां हुःगिर थाय छे. आ वात परम
सिद्धान्त इप्प छे अने तेथीज शास्त्राद्वारा गाय छे डे—

“ न तृणा परो व्याधिः न तोपात् परमं सुखम् ॥”

मतवण डे पराई वस्तुनी ज्ञानी हृष्टि-अलिंगापा सुनः सुनः करवा इप्प
तृणां समान डेक्क व्याधि, उपद्रव, डे हुःण नथी अने ओळ अनिष्ट हृष्टि-
अलिंगाने ज्ञान-विवेकी हाणी हृष्ट यथाप्राप्तिमां आनंदित रेखांडप
संतोष समान थीकुं डेक्क व्याधे साइं सुण नथी. अरुहे डे संतोष ओळ
परमं सुण छे अने असंतोष क्हो डे तृणां क्हो ओळ परम हुःभे ल्यारे
संतोषवांत समता रसमां झीके छे ल्यारे तृणांवांत भमतावश हुःभ-
सागरमां डूषे छे.

‘वणी निःस्पृहस्य तृणं जगत्’ निःस्पृही-निःक्षेभी-परम अंतेष्ठाने डेक्कनी
परवा छेती नथी, त्यारे ‘पारदी सृष्टा राणनारा तृणावांत बापडा हुनियाना
दास थई रडे छे.

न्यारे अरी संतोषवृत्ति प्रगटे छे त्यारे यडवर्ती ज्वेवा मळाराव्यंग्ये परम
तृणांनी घेवे पोतानी शान्य रिद्धि तच्च हृष्ट सुमुकुता आहारे छे. न्यारे भमतावश
तृणांतुर लिखारी अड रामानने पल्ल तच्च शक्तो नथी. आ वात सुषे
समल शक्य अनी छे तेथी तेन व्याधे सप्त करवा जडर रेहती नथी. ज्ञानी
विवेकी ज्ञानेचे संतोषवृत्तिमांज सुण गवेष्युं छे अने परमार्थ भुद्धिथी अरी
संतोष वृत्तिनुंज सेवत करवा आशइ कर्ती छे. परम पुढीपोतो आज सुदांसेअ छे के—

“मातृवत् परदारेषु, परद्रव्येषु लोप्तवत्।

आत्मवत् सर्वमृतेषु, यः पद्यति स पद्यति॥”

ये भद्रतवना इडरा उपर प्रथम प्रथमे के क्लेवायुं छे ते सदाय स्मर-
लुमां ताण्णुं रांभी वर्तवुं उचित छे. ज्ञानी-विवेकी संतत्वन युड्पोतो अेज
घेदी मार्ग.

“सहिष्युता अने कार्यं दक्षता.”

७ ‘डेक्कपिलु आणत नल्हवी गाणी काढी तेनी उपेक्षा करी नाभता नहिं.’
देक्क वातमां इधने हृष्ट रस्त्य रेहेलुं ल्यायेहे ज अेज. अनुसव करनाराअने.

ઠૃત્ય ચોદ માલ સુગ લંમોટું વિવેચન.

૩૦૫

સમજાય છે. વર્ષતું બાદીકીથી નિશીખણું કરવા જે એવાય હોય તે તે બાહેરથી જણાતી નજીવી વસ્તુમાંથી પણ બધું ઉપયોગી રહસ્ય મેળવી શકે છે. અવાનરો એદરકારીથી ડેઈપણ બાળતને નજીવી ગણી હસ્તી કાડતા નથી. તેથીજ તેઓ મહત્વનાં કાર્યો બધું રહાપણથી આને ઇતોહમંહીયી પાર પાડી શકે છે. જે લોડો નજીવી જેવી દેખાતી બાળતમાં ઉપેક્ષા કરે છે—એદરકારીથી તેનો કશો લાભ લેતા નથી તેઓ મહત્વની બાળતમાં પણ પ્રાય: ભૂવ ચાપ ખાઈ બેસે છે અને તેનું પરિણામ ગણ્યુધા નિરાશામાં આવે છે, જે અત્યંત ગેડકારંક છે.

કંડાય છે કે ‘હનિયામાં ડેઈ વર્ષતું નિરૂપયોગી નથી.’ હરેક વસ્તુ-માંથી કંઈ ને કંઈ ગુણ બધુણું કરી શકાય તેમ છે. વળી ‘રજ સરખી વર્ષતું પણ બળતે ઉપયોગી થએ શકે છે.’ ‘ગરજ પદે લારે ગવેઠને પણ કાડો કણ્ણો પટે છે’ એ કણેવત પણ હનિયામાં અસ્તિત્વ ધરાવતી હરેક વર્ષતુંની ઉપયોગિતા સિદ્ધ કરી આપે છે. સંસાર વ્યવહારમાં શુંથાયા છતાં કેટલાક લોડો પોતાની પાસેના ગણ્યાણાં સાધન વિગેરના ગર્વથી બીજાં એણાં સાધનવાળાની અથવા તેવાં સાધનવગરસનાની તમા રાણતાં નથી. એટલું નહિ પણ પોતાને પ્રાપ્ત પ્રાપ્ત જરૂરી ઈવતને નજીવા—નકારા—નમાલા લેખી તેમને સત્તાને છે, પીડ છે, તેમણે પોતાનું તુંડ ગિન્ઝશીખણું તણ હદ્દ બીજા પાધાની ઉપયોગિતા સ્વીકાર્યી અને તેમના તરફ ઉચ્ચિત નસ્ત્રી દ્વારાવની શુદ્ધ છે. આ વાતની સલ્લતા સમજનારા અજૂન પુરૂષો ગમે તેવા ઉચ્ચા અધિકારને પામ્યા છતાં અધિકારના મહદ્દી ડેઈ પણ માનવ વતિની અવગણુંનો કરતાં નથી. એટલું નહિ પરંતુ તેમની લાગણીને લગતે નહિ હુભવતા તેને યોગ્ય માન આપે છે. આવી ઉત્તમ કુનેદ્ધીયી કામ કરનારા ગમે તેવાં મહિત્વનાં કામ હોય ધરી પાર પહોંચાડી શકે છે. કેમકે પોતાના માનવ બંધુઓણાની શુદ્ધ લાગણ્યાણાનું ઉચ્ચિત માન જાગવવાથી, તેનો ઘટતો અલ્લાર કરવાથી તેઓ તેમના પોતાના પ્રત્યે લાગેલાંકે કરેડો માનવીએનાં મનને છુટી શકે છે. અને તેથી ધારેવાં કાર્ય બધું ઇતોહમંહીયી પાર હતારી શકે છે. પરંતુ એથી ઉલ્લંઘન કરીને અધિકાર આહિકના મહિવડે લોકથી અંતર રહ્યી, તેમની લાગણી હુલાવીને કે અજ્જલના નમુના મહત્વનાં કાર્ય કરવા નથી છે, તેમના કાર્યમાં અનેક વિનો ઉપરસ્તિય થાય છે, કેથી તેમને મોટી મુશીળતો વદ્યે પસાર થવું પછે છે અને ડેઈ બળત તો પોતાના છુફતું પણ જેણમ બોલી કેવું પછે છે એ અત્યંત ગેડકારંક બીજાનું છે. જે બીજી માનવ વ્યાનિયેને નજીવી—નકારી—નમાલી બણી તેની તદ્દન અવગણુના કરે છે, તેમની આંતરથી હુદ્ધયે છે, તેમને અનેક રીતે પરબે છે—સત્તાને છે તેમને કેમ અનેક ક્રીય-એક્ષે મળી કાળા નાગનો પ્રાણું લીધો હતો તેવા કરવિનું મહા વિરોધનાં પરિણિયે

૩૭૬

નૈતિકમાં પ્રકાશ.

અહુ કરયો અનુભવ કરયો પણ છે. એમ સમજુ શાખા, દીર્ઘ દર્શાઈ, ન્યાયી, પ્રમાલિક પ્રકૃષ્ટો ભીજન ગધાને ન્યાય આપતી વખતે પોતાનેજ તેમની તુલ્ય કથામાં ભૂકી જુઓ છે અને એમ કરી અચંત રહેમ નજર રાખી સહુ માનવાંધુઓ જાણે તો શું પણ હુનીયાના દરેક પ્રાણી વર્ગસાથે પ્રેમ લારેલી રીતથી વર્તે હે-વર્તાંનું પસાંડ કરે છે.

સાર-મતતથણ એ છે કે કે કે નાળવી બાળતમાં પણ ભૂલ કરતા નરી તે મહિલાનાં કાર્ય કુશળતાથી કરી શકે છે પરંતુ કે તેથી ઉલગ વર્તે છે તે મહિલાનાં કાર્યમાં બદ્દુસ્થ: નિર્માળ યથ છે. એટલે કોઈ વખત કે કાર્ય અદ્ય પ્રયાસથી સહજમાં થઈ શકે એનું હોય તે તથાપ્રકારની કુનેદના અભાવે મહા મહેનતે પણ કરવું મુશ્કેલ થઈ પણ છે. અને ઉલ્લંઘન 'સ્વર્ગાંથી ગજ' ની લેમ હુંદું વેતરાઈ જાય છે, કેથી કરતાનાં લારે સોસાંહું પડે છે. એટલે તેમાંથી 'કાગનો વાધ' થઈ પડે છે. ગંસ આ ઉપરથી દરેક અધિકારી અથવા ભીજ અધિકારી જનોએ જાવચૈતીથી એક ભીજ સાથે પ્રેમધૂર્દ લગી મળીને પોત પોતાનાં કાર્ય એક ભીજની લાગણીને જાચવી કરતો જરૂરનાં છે અને એમ કરવાથી કેવું સુંદર પરિણામ આવે છે તેની કંઈક આંખી આવી રહ્યો.

અધ્યાર્થી.

ચંદ્રરાજાના રાસાઙ્ગપરથી નીકલ્યો સાર.

(અનુચ્ચાન 'ધૂષ્પ રષ્યાથી.')

પ્રકરણ ૬ મું.

શાલાપુરિ પાઠ્ય કરતો ગાંગા ઉપર કોઢેલી વિરસતી વહુને કહે છે કે— “ એ તું ધરે રહી હોણ તો આ નગરીને કનકદેવજ કુનારને તું કચારે દેખત ? હું આવાં નવાં નવાં કેનુંક તને દોજ બનતાવીશ અને તારી ડેંશ પૂરી કરીશ; પણ તારે મારી સાથે મનમેળ રખ્યો પડ્યો. મારા વિના આરદેશ બંધો આકારામાર્દ હીનું કોણ અતિકો? ક્રજ જિદાંતમાં ચાસણું મુનિની ગતિ અચંત કહી છે બાંધી પાંખીનો બહુ ન્યાયો બાર થોળન જઈ રહે. મારી શક્તિતો લઈ વિનાની છે. ન્યાય પવન જાયરી ન શકે ત્યાં પણ હું જઈ શકું અને કોઈ ન કરી શકે તે કાર્ય હું કરી શકું.”

સાસુના સ્વસુખે ગાવા વણાખું ચાંબળીને શુલ્પાવળી ગોલી કે “સાસુલ ! આપ હુંણ છો તે બધું સાચું છે. આપની શક્તિની આજે મને ખાની થઈ

પરંતુ શેષ વાતમાં તમે ભૂલ જાણી છે તે એ છે કે ફનકલ્વિજ કુમારની જગ્યાએ જરૂર તમારા પુત્રજ હતા અને તેજ પ્રેમલાને પરણ્યા છે, એમાં મને જરાપણ અદેશો નથી. આમાં જે મારી ભૂલ હો તો મને ડાણો આપજો.” વીરમતીએ કહ્યુ કે—“હવે તું બધુ જાહી યદ્ય ગઈ છે તે જાણ્યું! મારા પુત્રને હોણટણો આવણો આપે છે. તુંનો જ્યાં રૂપવંત પુરુષ દેખાશ ત્યાં લાં ચંદ્રજ કહીશ! પણ મને મારા પુત્રની જાગ્રી છે, કેમકે તે મારે વશ છે?” આ વખતે વૃક્ષના ડોટરમાં રહેવ ચંદ્રાજન વિચારે છે કે—“રોણે જે આ મારી વાત જણાશે તો જરૂર હેરણ કરશે તંશી કોઈ રીતે મારી વાત જણાય નહીં તો હીક? આ પ્રમાણે તે વિચારે છે, સાચું વહુ વાતો કરે છે અને વૃક્ષ અનેક નગરોને પર્વતો ઉંઘાંઘતો ચાલ્યો જાય છે. એમ ચાલતાં હુસ્તી આલાપુરી દેખાણી. કુઠાંયો પોતાવા લાયા. પૂર્વ દિશા આનંદ પામી. એક બાળુથી અરુણોદાય થવાની રીતારી યદ્ય અને બીજુ જાણુથી ચંદ્ર પણ આવી પહોંચ્યો. આંગો તેના વનમાં મૂળ સ્થાનકે આવી જમીનપર સ્થિર થયો. એટલે સાસુએ કહ્યુ કે ‘વહુ! આ આપણો આગ આવ્યો; હવે વૃક્ષપરસ્થી નીચે હતરો.’

પછી બંને જણા નીચે ઉત્થાન પરંતુ લાગ્યોગયી ચંદ્રાજન તે વણતે પણ તેમની નજરે પડ્યા નહીં. પછી તે અંતે પવિત્ર થવા માટે નાણકની પુષ્પ-રણીમાં ગઈ એટલે ચંદ્રાજન ડોટરમાંની નીકળી ઉત્તાવળો પોતાના મહેલમાં આવ્યો અને વેશ બદલ્યો નાખી નવો વેશ ધારણ કરી પોતાની શાયામાં સુઈ ગયો. સાચું વહુ, પણ હસ્તાં રમતાં પોતાના મહેલમાં આવ્યા.

પછી શુણુવળીને કંણા દાઢને ચંદ્રાજન પાસે મોકલી શાને વીરમતીએ નગર લોકને આપેલી નિદ્રા અપહરી-લોક સૌ જાગૃત થયું અને પોત પોતાના પ્રાતઃકાળ ચંણાંધી પદ્ધ કરવા લાયા. રાત્રિની હુકીકિત કોઈતા જણાવુનાં ન આવી. શુણુવળી ઉત્તાવળી પોતાના મહેલમાં આવી. લાં તેણે પોતાના સ્વામીને નિદ્રામાં પહેલા હીડા. ચંદ્રાજનએ પણ તેને હીઠી. શુણુવળીને એક તરફથી શાંતિ યદ્ય પણ બીજુ રીતે જેહ થયો કે મેં પાપિણીએ સ્વામીને આવી વોર નિદ્રામાં નાખી હીધા તે હીક ન કર્યું. પછી તેને જગાડવા કંણાના ડણકારા હીધા એટલે ચંદ્રાજન કપથી આપણસ મરડવા લાયા. તે વણતે શુણુવળી અનણણી યથિતે જોડી કે—“હે નશુહીના વીરા! રાનિ વ્યતિત થઈ; પ્રભાત કાળ થયો માટે હવે ઉડો. આજની રાની તાં મારે વૃથા ગઈ છે કારણ કે મેં આખી રાત ઉનગરે કથો પણ તમે તો જગાડતાંએ નાયા નહીં. એવા નિશંતે ઉંધી ગયા હતા કે જાળું સુમારાં કોઈ રાજ પાસ્યા હો. અથવા કોઈ રાજકન્યા જાયે

પાણિશ્વાદથી કર્યું હોય ! એમ જલ્દાય છે. હું નાથ ! હું તો જીતો. ઉદ્ઘાચાળ બિપર રૂર્ધ કર્યો છે. ગાડે આપના મુણનું ગને દર્શન આપિંદા. હું ગંગાજાળ ને દાતણ કર્યા છું; માટે દાતણ ધાવન કરી દ્વો. આ વણત રાજસુયો તો આપાંગમાં જઈને મદ્દ કુરુ કરે. રાજસુયાનો વળન પણ થઈ ગયો છે ગાડે હું સાચુના વલ્યા ! હું તો કોણ કે આદલા ણદા મોદા હિતો છે. એં જાણ્યો તો તમારી વિમાતા આવીને ડાંડો આપશે.”

શુલ્યાવળીના આ પ્રમાણેના વચ્ચેનો સાંભળીને ચંદ્રાળ ક્ષેપ નિદ્રા તથ હાંકડા હાંકડા થઈને ઉક્કા. અને ગોદ્યા કે—“ બહુ વણત થઈ ગયો, સુર્ય ઉદ્ઘાની પણ અભર પડી નહીં. રાત્રીએ માચવું થયું તેની ડાંડથી મારું હીલ વધારે વેરાઈ થયું તેવી રાખ્યુંકાં ! મને ઉત્તો વાર લાગી. પણ આજે તો તમને પણ આગળી સતતો ઉનગરી લાગે છે. કેમકે આગો તે વાત કરી આપે છે. વળી આજ તો અત્યાર્થીજ પ્રીતિ વિશેષ જાતાવવા માંડી છે. વળી આજની વાત તો કાંઈક રસ્તીલી લાગે છે કેમકે તમે પણ વાણીઓશાઈ રંગ જાતાવવા માંડ્યા છે. એમ જલ્દાય છે કે આજે રાતે તમે કાંઈક કિંદા કરી આન્યા છો. આજના ફંગજ કુદા જલ્દાય છે તો હું હેઠે અમને વાતતો કરો કે રાતે કયાં ગયા હતા ? પછી અમને જગાદવાની હેતાળી વાતો કરો.”

શુશુલાળી બોલી કે—“ હે સાહેબ ! હું આપના ચરણ કર્યા છોડીને કયાં જઈં ? હું તો કાઈ રાતની વાત જણુતી નથી; પણ તમે કાઈ રાતી રમી આવ્યા લાગો છો. મારાથી આપની આજ્ઞા વિના મહેલ બાહ્યર પગ પણ કે દેવાય ? માટે તમે અરેખરી વાત કર્યી દો.”

આ પ્રમાણેના રાણીના વચ્ચેનો સાંભળીને ચંદ્રાળ વિચારવા લાગ્યા કે ‘આમાં આને થીલદુલ વાડ નથી. માત્ર એક રાતીના પ્રસંગમાંજ કે અરદા અને જાચા બોલી હતી તે વાંદી અને અસત્ય બોલનારી થઈ પડી. આમાં વાડ માત્ર વિગાતાનો છે. એમ શ્રીકૃષ્ણનું પાણી કર્યું રાત્રાનું ચંગમથી વિપ્રકૃપ થઈ નથી છે તેમ સાચું જનો પણ હું ચંગલિથી વિકાર આપી નથી છે. ચંગની ઘડીના ચંગમથી અદ્વારને પ્રાદાર અહેન કરવા પડે છે. હુણનો જંગ આગારા કેવો છે. તે બધી વિશ્વિમાં સુકૃતાનાર કરે છે. વળી નારી, વારી, તવાર, નેવ, અથ ને નરેશ નેમ વળીએ તેમ વળે છે.’ આ પ્રમાણે વિચારીને પછી ગોદ્યા કે—“ હે પ્રિયે ! હું બીજી બીજી વાત પરી સુધીને રાતી કયાં રમી આવ્યા તે સાચું કહો.” શુશુલાળી પતિને લેણવવા માટે કદિપત વાત કહેવા લાગી.

“ હે સામી ! વંતાંદ્વારી પર્વત ઉપર નિશાળા નામે નગરી છે. લાં મણ્ણુ-

પ્રભ નામે વિદ્યાધર રાજ છે, તેને ચંદ્રલેખા નામે સ્વી છે. રાન્નિહિત્ય કુળ વિલાસ કરે છે. તમામ વિદ્યાધરને પોતાની આજ્ઞાને આધીન જાણી હીથા હે. ગાંધી શુરૂ ગદારાજ પાસેથી યાગાદિકનો અધિકાર આંસળી યાગ કરીને ચાજ રાન્નીએ આસા નગરી ડિપર આવ્યા, તે વખતે વરસાહ ચ્યાલ્યું બાદું પ્રવન નીકળ્યો એટલે તેનું વિમાન થંભાલ્યું-ચાલી શક્યું નહીં. એટલે વિદ્યાધરનીએ પૂર્ણું કે “હે સ્વામી ! આજે આહી અફાળો વૃષ્ટિ કેમ થઈ અને આપણું વિમાન કેમ થંભાલ્યું ? ” વિદ્યાધર કહે—“એ વાત કંઠવાની નથી. આપણે મારડી વાત કરવામાં નહોં હો ? ” એટલે તો વિદ્યાધરનીએ હડ લીધો કે જરૂર કહુને કહે. ” એટલે વિદ્યાધરે તેનાથી આકીને કહ્યું કે—‘આ આલાસુરી ડિપર કેઈ હેવતા ઝ્યાન થયો છે, તેણે રાજને પરિતાપ ડિપનવવા આ વૃષ્ટિ કરી છે—અને રાજના પુર્ણ પ્રતાપથી આપણું વિમાન થંભાલ્યું છે.’ લારે ખેચરી હોલી કે ‘ઓએ કેઈ ડિપાય છે કે જેથી એ રાજને કંઈ અચુક્યાશું ન થાયે. જે એવું ચારમથ્રી હોય તો પરોપકાર કરવા ચોય્ય છે.’ વિદ્યાધર કહે કે ‘મારાથી તો શું થઈ શકે પણ એક ડિપાય બાલ્યું છું તે જે તેની વિમાતા કરે તો રાજ ડગરે અને વિદ્ધ વિસરણ થઈ જાય.’ પછી વિદ્યાધરી પોતાના સ્વામીને લઈને તમારી માતા પાસે આવી અને કહ્યું કે ‘હે માતા ! તમારા પુત્રના ડિતનો ડિપાય મારા પતિ કહે તે જાંસણો.’ વિદ્યાધરે કહ્યું કે—‘પવિત્ર સ્થાનકે શ્રી શાંતિનાશથુના મહા મંગળમય ણિણતું સ્થાપન કરીને તોની પાસે પંચ દિપક કરી તમે, રાજની રાણી અને મારી પત્ની આજી રાત્રી પ્રભુના શુણું ગાનવડે રાત્રિ જાગરણ કરો અને પ્રભાત ચાય ત્યારે આ કંણા લઈને તમારા પુત્રને આડાંને કે જેથી તે સંજ્ઞ થઈ જશે અને વિદ્ધ માત્ર નાશ પામયો.’ વિદ્યાધરે આ પ્રમાણે કહેવાથી આપની વિમાતાએ મને હોલાવી અને એમે આજી રાત્રી વિદ્યાધરે કદ્યા પ્રમાણે જિન શુણું ગાનમાં વ્યતિત કરી. પછી કંણાવડે મેં આપને જગાદ્યા અને તે વિદ્યાધર સ્વસ્થાનકે જણો. આ પ્રમાણેની આમારી રાત્રી સંખાંધી હકીકત છે.”

ચતુર ચંદ્રશાળએ તે બાધી વાત સાંભળી લઈને કહ્યું કે—“તમે જાચ્યે-સાચ્યે વાત કરી. પતિમતા સ્વીનો એ ધર્મ જ છે કે-પતિના ડિતમાં તત્પર રહેલું-પતિને માટે સ્વી અદ્ભુત પણ કરે, સુદ્ધુત તો વિશેષે કરે. સ્વી નિરંતર પતિની લક્ષ્ણવાળીન હોય અને માતા તો પુત્રનું ડિત કરે તેમાં નવાઈજ શી? તમે મારે માટે આખી રાત્રીનો ડિપાય કરો તે મોટી મહેરણાની કરી. મારી તમારી સાચી ગ્રીતિમાં એ ઘટેજ છે પણ મને એમ લાગે છે કે તમે જૂડું કહેણ તો કાળજા કાળ થઈ જવા જેઈએ અને સમુર આરા થઈ જશો. જેઈએ. તમે મારે માટે આજી રાત ડિપાય ન કરો

तो जीवुं क्षेत्रुं करे? कारणु के आपा माणव हेसनो लार चांपलदे ७५८ आवी पथो ज्ञाय छे. हे चांप्रानें! हुं तमारी वात साची जगतुं शुं मने तमारी प्रतिवी छे. आणी रात्रि जिनयुजु गताय एवां लाग्य क्यांगी? जिने-क्षेत्रनी अडिट इरवाथी प्राणी लवनो पथु पार आणी ज्ञय छे. तसे जेम आणी रात्रि जिनयुजुगानमां व्यतिर ईरी तेम मने पथु भव्य रात्रीचे अवुं स्वातुं आव्युं ते-“ नाहुं तमे सासुखनी साचे अहींची आठारसो. डोस इर विगणा-पूरीचे गया अने त्या एक महा इपवंत पुरुषने परेषुतो लेचे अने पाठा आही आव्या. ” मारा स्वभावामां ने तमारी वातमां धर्षुंज चांतर छे पथु स्वभावां शेना होय? तमे अनुसन्धुं ते साच्युं! अमां गोदानी शंडा पथु डेम करी शक्य? कारणु गेमां साच्युं शुं ते तो परमात्मा वांछे. पथु आ नांसारनी जेम स्वप्न गेहुं होय छे अने प्रतिवता केंहे ते साच्युं होय छे. ”

आवां पतिनां वचन सांखणी विकिपत थधने शुशुवणी पतिने घोटा पाउवा मारे “ स्वभा तो नृदां ज होय छे ” अमज्ञाववा गोली ते-“ हे स्वामी एक शिवना पूर्णरीचे स्वभावामां आएुं शिवमंहिर सुखदीचे लरेलुं हीदुं एटवे नगीने तरतन चेतानी ज्ञाति पांधीने जमवातुं नेतदूं आणी आव्या. पधी आवीने जेवा मांज्युं तो भीडाई भीवृक्ष दीडी नदी. एटवे निच्यारुं ते-शिवे बधी सुखदी अपहरी ज्ञाय छे. अम विचारी बारस्या णांच करीने सूतो. पाळदो पेहार देव्हे एटवे ज्ञातिवर्ग णेंवा लां लेणा येतो. तेषु त्या लेजन सामधी भीवृक्ष दीडी नदी तेम पूर्वदीने पथु दीडी नदी. शिवमंहिरना द्वार पथु णांच दीडी. पधी तेने जगाऊ एटवे ते योव्या ते-“ जरा राह नुओ, इमस्या काल रात्रीनी केलुं स्वान आवे ने सुखदी देषुं तो तेनावहे तमने जमडुं. उतावणा न थायें. ” एटवे णांच योव्या ते-“ तुं शुं अमने स्वभावी सुखदी जमाहवानो होतो? ते सुखदीची शुं माणुसनी लुअ लांगती होतो? मारे वेळो थध गेतो लागे छे. ” अम कडी दों पोत चेताने डेकाहें गया अने पूजारी पथु मनमां पूजायें. के भें लुक करी. मारे हे नाथ! स्वभा तो एवां घोटक होय छे. तमे मने स्वभावां विगणापूरीमां जेध ने हुं तो अहीं तमारी पासेन इती. वगी ज्ञान आवतां धनीशें डोऱ थाय एटलुं ते कांध वकाय आवाय? मारे ए वात कांध भानवा घेवी नदी. ”

यांदानतचे इलुं ते-“ हुं तो तमारी लंकी कडूं शुं. मने तमारा वचने पूरेपूरी विद्यास छे. ” एटवे शुशुवणीना पगमां कांधक नेह आव्युं तेथा ते गोली ते-“ हे स्वारी! आप स्वभा संगांची आंटी भीवृक्ष तथ दो

ચંદ્રાળના રાખ ઉપરેણી નીકળતો જાર.

૩૧૨

અને કે વાતે રસ વષે તેવી વાત કરો. અમે આખી રાત તમારે માટે ડિન-ગરે કર્યો તે તો તમારા હૃસાથમાં પણ ન આયો. લસે તમે ધ્યાનમાં ન વ્યો પણ પરમેશ્વર તો જાણે છે. એ તો જગતમાં ઉખાણે છે કે-ઘાણે વેગથી દોડે પણ અસ્વાને તેની ખણર ન પડે. તમે પણ તેમજ કરો છો. તમે ચામારી વાત બધી હંગીમાં કાઢી નાણો છો તેથી તરે કાંઈકથી વલિકુંકળા શીળી આવ્યા લાગો છે; વળી તમે વાત કરીને ડલઠી દળામણી જતાયો છો. પણ હું તો બોળી તે કાંઈ સમજુ નહીં અને બંધી વાત રાયે બની હતી તે તમને કહી હીધી. બાકી આવી હંગી કરવી આપને ઘરતી નથી. ડેમકે હસવામાંથી અસરું થઈ જય છે. કયાં હું ને કયાં વિમળાપૂરી? તમે મને લાં કયાંથી હીડી? હું ઘરનો ઉણદો તજુને ખાડાર જતી નથી તે એટલે હર આપની આજા વિના શી રીતે જાઉ? માટે એવી નકારી વાત કરવી પડી મુકો. ”

ચંદ્રાળ ઠેડે કે—“ રાણીલુ ! એમાં રીસ શામાટે ચહાયો છો ? જેમ તમારા મનમાં આવે તેમ ગાંધો ખાત્મો તેમાં મારી કથાં ના છે ? મેં મારા સુપ્તની વાત કરી તેમાં તમને જોહું ડેમ લાગે છે ? મારી હસવાની તો એવ છે. તે શું તમે આટલા વણતના પરિચય છતાં જણુંતા નથી ? પણ મારું સ્વરૂપું જોહું નથી એવો મને તો નિરધાર છે. સાચું વહુનું સરણે સરણું જોહું મળ્યું છે તો ખુશીથી મોજ કરો. પણ કૃપા કરીને મને પણ કોઈકવાર એવી મોજ ભાતાવજે. એમાં મારી શાંકા ન રાણશો. તમારા કામ લેચું મારું પણ કામ થશે. અચિઠીની બાકીમાં ઢાકળું સીલુ જશે. બાકી મેં આજેજ તમને જોડી-માંથી જોરાય જાગે તેમ એળાખ્યા; આજ સુધી બનાયર એળાખ્યા નહોલતા.”

આ પ્રમાણેના પતિનાં વચ્ચેના સાંકણીને શુશ્વાવળી બોલી કે—“હે વાતમ! આપ વગરગુંઠે શામાટે મેલાં મારો છો ? આ વચ્ચેનાથી તો આપનો પ્રેમ મારા પ્રત્યે પાતળો પણ્યો હોય એમ જણુથી છે. તમે બોલી બોલીને હસતાં હું લાગે છો. મને લાગે છે કે કોઈ ચારીચો તમને મળી ગયો છે કે કેણું મારી બોલી ચાહી આખી છે. પણ હે જ્વાગી ! હું વાંકી વાડ નીચે ન આવું. અને અંડાની ધારપર ચાલે તેમ ચાલું છતાં તમે વહેતા ખળદને આર મારસ્વા જેવું કરો છો. કંતને સૂતો મેલે તેવી સ્થીએ હોય છે, પણ તેવી હું નથી. આપ તે ખાંદીથી માનજે; માટે આપ ચાવા પ્રીતિનો નાશ કરનારાં વચ્ચેના ન બોલો તો હીક પછી આપની સરળુ. ”

આના જ્વાગમાં ચંદ્રાળ મંનજ રહ્યા. એટલે શુશ્વાવળીએ પણ પોતાનું જાખળું આગળ ચલાવ્યું નહીં; પરંતુ ચંદ્રાળના શરીર ઉપર વિવાહને લગતા

કેટલાંક ચિન્હો તેણે હીંડાં એટલે બાદયું કે જરૂર કોઈપણ પ્રકારે સ્વામી વિમ-
ગાયુંથી અમારી પાછાના આવ્યા જલાય છે ને પ્રેમકાને તેઓનજ પરદયા લાગે
છે. આમ ચોકસ ખાની થયા છતાં પણ પતિ પાસે અરી વાત માની નહીં, અને
પતિને જમાઈને લાગ જેઠ ડ્રાવળી ઉતાવળી ખાસુ પાસે હોઈ ગઈ અને તેમને
ચંદ્રાન સાથે થયેલી વાત કહેવા લાગી.

હુએ ભોગી ગુણવળી અરી વાત વીરમતીને કહેશે અને પરિણામ તેનેજ
અત્યંત હુઃખરૂપ આવશે. પરંતુ અજાન મનુષ્ય કુસંગમાં પડ્યા પણી પોતાના
લાભને પ્રથમ વિચાર કરી શકતા નથી; પાછળથીજ પસ્તાય છે. ગુણવળીને
પણ તેમજ થવાનું છે તે બધું હુએ આપણે આગળના પ્રકરણમાં જોશું. હાલ્યો
આ પ્રકરણમાં સમાચેર રહ્યા વિચારિશે.

પ્રકરણ દ્વારા સાર.

આ પ્રકરણમાં કુસંગથી થતી મારી અસર અને સ્વીચ્છિત્રનું પ્રત્યક્ષ સ્વરૂપ ગુણ-
વળીએ બનતી આપણું છે, અને વાગ્યાં કેમ પોતાય છે તે ચંદ્રાનજએ શિખાયું કે.

આરંભમાં તો વીરમતી આપ વળાય કરે છે, અને ગુણવળી સાંભળે છે.
તે વખતે ગુણવળી પ્રેમકાને પરણનાર તો પોતાના પતિ ચંદ્રાનજ હતા એમ
કહે છે, પણ વીરમતી માની શકતી નથી. તેના માનવામાં એ વાત આવે પણ
કેમ? કરણ કે આપણે દૂર ચંદ્રાન શી રીતે આવે? તેને કંધાં અખર છે કે
તે તો સાચેજ વિમળાપૂરી આવ્યા હતા ને પાછા પણ સાથેજ આવે છે. ચંદ્ર-
નજ પણ આ સાસુ વહુની વાત આંબળી રણે ઉઘાય પડી ન જવાય તેની
ચિંતામાં પઢે છે, અરણ કે પોતાની અપરમાતા કેવી દૂર છે તે તેઓ બહુ સારી
રીતે જાણે છે. એકવાર તો વળી ભાગ્યહશા આરી આવે છે અને જાડ ઉપર્યુ
હતરતા પણ જેમાંથી એક જણ તેને દેખતા નથી. ચંદ્રાન પોતાના મહેલમાં
પહોંચી જાય છે ને હતા તેવા સૂઈ જાય છે; પરંતુ મીઠાળ કંકણાદિક કેટલાંક
લગ્નના ચિંહ રહી જાય છે, તે ઉતાવળાને લીધે તેના ધ્યાનમાં રહેણું નથી. એકવામાં
તો ગુણવળી કંણ લઈતે આવે છે ને ચંદ્ર નજને જગાડે છે. હુએ પણી કષ્ટ-
નાયક શરૂ થાય છે. બંને જાણા ધારી કષ્ટકળા કેળવે છે. પરંતુ એકની વૃત્તિ
શુદ્ધ છે ને બીજની અશુદ્ધ છે. ચંદ્રાન સાચા છે ને ગુણવળી જોઈ છે. તેને
અપરમાતાના અદ્ય પ્રશ્નગમાં પણ કુસંગની મારી અસર હુંડો હુંડ વ્યાપી ગઈ
છે, અને તેથી તે ઉપર ઝૂફું અને છેવે હુહુણું ઝૂફું બાબે છે, રીત
ચડાવે છે અને સ્વી ચરિત્ર કેળવે છે. આ બધું મૂળ હકીકતમાં વિસ્તાર્યી
જણાવેણું છે. અહીં તો માત્ર તેનું રહ્યા વિચારવાનું છે.

ગુણુનણી કેવી શુદ્ધ સત્તી સ્વી જ્યારે પતિની વંચના આટલી બધી કરે અને પોતે સમજે કે પતિ મોકે છે તે વાત સાચી છે ત્યારે પણ અરી વાત ક્ષી ન શકે ત્યારે તે સ્વી જતિનો જ હોય કે તેમાં બીજું કાંઈ કહી શકાય ? સ્વી જતિ ને તેમાં લાગ્યો કુસંગ એટસે વિષને વધાર્યો કેવું થાય છે.

ગુણુનણી પતિને જગાડ છે તે પ્રસંગમાં કર્તાં કહે છે કે—“ જે નર હોય નિરુદ્ધમી, વળી ભૂરખ હોય શોખર હોય જોહ; વેળા કરણું નરેશની, દુધડીએ હો ડ્રેગાટ ગમે તેહ ” અર્થાતું સૂર્યોદય અગાઉ તો અવશ્ય જગતું જ બેદબે. તે વગન કે ડંઘમાં વ્યતિત કરે છે તે કથાં તો નિરુદ્ધમી હોય અથવા ભૂર્ખ શિરોમણું હોય એમ સમજવું. ગુણુનણી પતિને કહે છે કે—‘ તમે આપી રૂપ ઊંધી ગયા-જગ્યાજ નહીં તેથી મારે તો આ રાત બધી અદેખે ગઈ છે? નુંચો કીની કણા ! આગળ ચાલતા વળી અપરમાતાનો લય ણતાવે. છે કે—નો મેદા ઉક્ખાની વાત તે જણુંશે તો ડણડો આપશો. ’ હું ચંદ્રાન સાંભી કપટ વલુ માಡે છે. તે પણ કહે છે કે—‘ તમે કાંઈક ઉન્જગરો કરી આવ્યા લાગો છો, માટે દેની વાત કરો. ’ ગુણુનણી તો તદ્દન આજાણીજ બણી લય છે કે—‘ હું અગ્યા-લમદ્દી આજાવિના મહેલના ડંખરાની બહાર પગ પણ કેમ મૂકું ? માટે હું તો કાંઈ ગઢાં નથી. ’ છે કાંઈ અચાત્યમાં પાણી ! ચંદ્રાન હુણું સુધી પણ તેને કુસંગતો દોષ લાગ્યાનું જ બણ્ણી વદન નિર્દોષ સમજે છે. તે પ્રસંગમાં કવિ કહે છે કે—

હુઃસંગતિથી સાધુન, પામે વિકૃતિ વિકાર;
યંત્રવથી સંગતિથી, અહિરી સાહે પ્રહાર.

આ સંબંધમાં ગાયને થયેલી ગૈણિકાની સેણનને અંગે પણ કહેવામાં આવે છે કે-એક રાત્રિપ્રસંગેણ, કાષ્ટ્રવંદાવિંદવના. તેમજ “ પાણી પીણો ઘડી, ને આર ખાય અલર. ” એવી અનેક કહેવતો ને દૃષ્ટાતો છે; પરંતુ તે બધાં અભૂતે રમરણુમાં આવતાની જરૂર છે. હુણની સંગતિને ડેયલાની પણ ઉપમા આપી છે કે-તે ટાઢો હોય તો કાળું કરે ને ઉપણું થાય તો શરીરને તપાવે. અર્થાતું કોઈ પણ સ્થિતિમાં હુણની સંગતિ હાનિકારક છે, સર્વચા વનર્ય છે.

જ્યારે ચંદ્રાન કહે છે કે—‘ હું કે સ્વી ચરિય છેઠીને સાચી વાત કહો. ’ જ્યારે ગુણુનણી વિવાધર અંગાંથી આપી વાત નવી જેઠી કાઢે છે. નુંચો શૈઠા પ્રસંગમાં પણ અસત્ય ગોલવામાં તે કેવી પાવરથી થઈ જાય છે. વિવાધરની ઝ્યામાં પણ ક્ષી કીના આચણની છુત થાય છે એ ધ્યાનતમાં લેવા ચોચ્ય છે. આ જેઠી કશેલી કથા ચાંલજયા પણી વળી ચંદ્રાન ચાય છે કે—‘ સતીઓનો એ ઝર્ણ જ છે, અને તમારા જેવી પ્રતિતા સ્વી ને મારી છેતલારેલી માતા મારે

मार्गे आणी सर्वी किनयुग्मान न करे तो भीकुं द्वेष्य करे ? जे तमे झुळूं घेण्ये तो कागडा काणा थध नव्य. हठयादि दृष्टांते अही तेना कडुवाने तदन असत्य करावे छे, अने पढी पेताने स्वम आव्यानी वात करे छे. ते सांलग्नी चतुरा शुशुवणी यमके छे. तोपथ्य चांदरान ‘स्वमा कांठ साच्चा होता नव्ही’ येम कडु छे एट्ये वणी पगमां न्यर आववाची खेळा स्वम उपर एक वात कडी भताने छे. एट्ये चांदरान वणे छे के—‘तमे कडु आ ते जरी वात छे, हुं तो मान दांची ४३ छुः.’ आम अनेने आनंदमां राणी कर्ता भीजे घंट पूर्णे करे छे.

ग्रीन अंडना प्रारंभमां कवि पेतानी युद्धिनो जरा चमत्कार अतावे छे. सम्यक्त्वता स्वदृप्यने योआ शहदोमां पछु प्रगट करी भतावे छे. अही स्वमत परमतुं स्वदृप्य पछु ठीक अतायुं छे. अर्थवाणा सामग्री अर्थ पछु णाडु विस्तारे ने णाडु चेष्य दीते लातामां आण्यो छे. ते अही भताववा जतां णाडु विस्तार थक्कीलय तेम छे, तेमज कथाना रसमां लांग पटे छे तेथी भतावेस नव्ही. तेना अर्थने अर्थवाणा रसनी णुकमांची ग्रीन अंडना प्रारंभनो लाग वांचवानी आस लतामध्य उत्तरामां आवे छे. ए प्रश्नंगमां कर्त्ताचे दर्शननुं स्वदृप्य भतावतां क्लब्यं छे के—

के हर्षन हर्षन विना, हर्षन ते अतिपक्ष;

हर्षन हर्षन छेय जिहां, ते हर्षन प्रत्यक्ष.

बांगलण नर बाणभरि, दचे विविध आयास;

तिहां हर्षन हर्षनितछें, नहीं निहर्षनाल्लास.

लखित विजांगी लांगभर, लैगभारि नय लूर;

शुद्धाशुद्धतरेकडती, लाणे जगचुरु चुर.

सान्यो कर्ता तो किशु, आणुमान्ये शो निशेप;

सन भान्यो भान्या विना, न गऱ्य मसता ऐण.

अत मत जनक रहमतता, सिंधुजनक अमसत्य;

धन्य गाणे रुभजानव्ही, भात अनेक ओक्त्य.

आ पांच हुद्दांचा केवा जालिसर्थकी लरेका मं ते विचारवा योज्य छे; लापामां होवाची भास्तव होय तेस समवत्तुं नव्ही. केवटना हुडगां अन्य मतो थाक एकांतवाही छे ते जनाची आण्युं छे. अर्थ यश्य ए हुडनो घाणा विस्तार श्वी पूर्ववामां आण्यो छे.

गाठडी वात प्राचंगिक जडुनी देवताची कडी, दंव प्रस्तुत प्रसंग उपर गाठडी. आंदरान शुशुत्वणीने व्यंगमां णाडु णाडु दीते कडे छे; पछु ते चतुरा छतां व्यंगने पूर्णे समझती नव्ही अने विचक्षण मुश्खनी पासे स्वीचित्र चका-

वात वायु छे. चंद्रशनन वातमां विसामो लाई लहर्ने अरी वात कहेता बय छे; परंतु शुण्डीयक छतां खीनतिना हृषीथी नहीं तज्जयेती शुण्डावणी अरी वात कही शकती नथी. स्वभा ज्ञेयां छाय छे तेम साचां पञ्च छाय छे. शुण्डावणी जाणे छे के रवम साचुं छाय के ज्ञेय पञ्च चंद्रशनन कहे छे ते वात तो साची छे; परंतु अङ्क वार ना पाइया पछी साची वात कही शकती नथी. एटसे अङ्क असत्य छुपावता भारे उपरा उपर असत्य भोलबुं पछे छे. अङ्क अपेक्षाएँ जे वात साची छाय तेज वात धीछु अपेक्षाएँ हुदय ज्ञेय छाय ज्ञायी थाय छे. शुण्डावणी कहे छे के—“ जे झूँडो छाय ते ज्ञाने झूँडा गाले, पैतानो अवगुण जाणे नहीं अने धीनतो वांड काढे, वणी उलटो चोर आरी करे ने क्रायवाणने होइ. आ प्रभाषे तमे करो छो.” जे शाहो अक्षरे अक्षर पैताने मणता आये छे, ते मुर्खपाण्याची धीनतो लागु करवा बय छे, परं लाशुती नथी के प्रवीणु पुरुष पासे ते वात चाली शकती नथी.

चंद्रशनन कहे छे के—“ जले तमे गमे तेम वर्ती पञ्च अमने थोयेक लाग आपने.” आ प्रभाषे रूपय शाहोमां कहे छे तोपञ्च हुनु शुण्डावणी तो चोरीन थया करे छे. ते कहे छे के—‘धार्याने सूता वेच अवी स्त्रीमा छाय छे अरी, पञ्च ते धीछु, हुं तेवी नहीं.’ आम कहेती वर्खत विचारती नथी के ‘हुं शुं कहुं छुं ? भरेपरा तो मेज सूता वेच्या छे.’

चंद्रशनन हुये वातनो उपसंहार करे छे-आगण चलावता नथी. अने हात धावन राहनाहि करी लोकन करे छे अने भरी राजसभामां बय छे; परंतु राहनाहि करतां तेमना शरीरपर रसी गयेता थीठी, कंडु, काकण, तिलक अने मिठेण कंठाशाहि लग्न चिन्ह शुण्डावणीना जेवामां आवी बय छे. एटसे पौते शंडा करवामां अरी हुती अम कहेवा उतावणी थयेती ते चंद्रशनन भेदलमांथी नीडगता के तरतब चाताने आमां लाल थयो के छानी? पतिनुं हित थयो के अहित? तेनो कांध पञ्च विचार कर्या शिवाय सासु पासे दोडे छे. हुये ते थावी वात सासुरो दरशे अने पौते शंडा करवामां साची हुती अम कही कुलाये. परं तेनुं परिष्कार तेनेज अपरिमित आंसु भाइवामां आवयो. आ वात आपणे हुये पठीना प्रकरणमां वांचयु. कारणु के शुण्डावणी शुं कहे छे अने ते उपर्थी वीरमती शुं विचार करे छे ते पञ्च लालवानुं आडीमां छे. आ प्रकरणु आणामां कप-टाटुक अनि स्त्री अस्त्रित तेमज व्यंगवाणीना प्रदार वर्षयेको छे. समझ्नुने ते धयो देवावायक छे, स्त्रीनतिने पूर्वपूर्व समजवालायक छे, अने कुसंगनां दोपथी नास पागवालायक छे. हुंकासा आटलुं कही आ प्रकरणुतुं रहस्य समास करवामां आये छे.

इंद्रिय स्वरूप.

इदं एटसे परमेश्वर्यवान् आत्मा, तेनुं चिन्हं अथवा तेनी उत्पन्नं करेकी ते ईद्रीयो छेष्वाय छे, ईद्रीयो पायं छे. आत्र (आन), अक्षि (आण), प्राण (पाइ), रक्षन (लग) अने उपर्यन्त ते (उपर्यास). ये हरेकनां गो गो लेद छे. १ द्रव्येंद्री अने २ लाव्येंद्री.

द्रव्येंद्रीना बो लेद छे. १ निवृत्तिरूप द्रव्येंद्री र उपकरणरूप द्रव्येंद्री निर्वृत्ति एटदे आकृति. तेना पायु बो लेद छे. १ बाह्य ने २ आंतरंग. बाह्य निवृत्ति ते हरेक प्राणीने तेमज मनुष्यने बुद्धा बुद्धा आकारवाणी प्रत्यक्ष हेणाय छे ते. आ बाह्य निवृत्तिरूप द्रव्येंद्री अनेक आकारवाणी छेवाशी तेनुं स्वरूप छेष्वाय नेशक्य नथी; डेमडे एक ओप्रेंट्री ल्यो तो तेमां मनुष्यना, बाथीना, घेडना, गायना, लोंगना एम हरेक प्रेंट्री प्राणीना कळनी बाह्याकृति बुद्धा बुद्धा प्रकारनी छेय छे.

अभ्यंतर निवृत्ति सर्व ज्ञातिमां समान छेय छे. तेने आश्रीने तेना संस्थानेनुं नियतपछुं आ प्रमाणे टेहेलुं छे.

- १ आत्र कळना पुण्य केवा मांसना एक गोबद्धरूप छेय छे.
- २ अक्षु मसुरना धान्यनी आकृति तुव्य छेय छे.
- ३ प्राणु अतिमुक्तना पुण्यनी केवी-काढवीनी आकृतिवाणी छेय छे.
- ४ छुन्हा झुरपना एटले अस्त्राना आकारवाणी छेय छे.
- ५ उपर्यन्त विविध प्रकारनी आकृतिवाणी छेय छे; डेमडे शरीरनी आकृति ते तेनी आकृति छे. तेनी बाह्य ने अभ्यंतर आकृतिमां लेद नथी.

इंद्रियोनी बाह्य आकृति अड्डानी उपमावाणी छे अने आटरनी आकृति अड्डानी धारा केवी कठी छे. ते अत्यंत निर्मिण पुढगारूप छे.

बाह्य आकृति ने अभ्यंतर आकृतिनी शक्तिविशेष ते उपकरण द्रव्येंद्री छे. अभ्यंतर आकृतिना संपाठमां गो विडव्य छे. डेअ॒ अत्यंत नवच्छ मुढग-गारूप आंतरंग आकृति क्छे छे, अने डेअ॑ शुद्ध आत्म प्रदेशरूप आंतरंग आकृति क्छे छे. उपकरण द्रव्येंद्री शक्ति अने शक्तिवान् अलिङ्ग छेय छे तेथी आंतरंग निवृत्तिथी बुद्धी परी शक्ती नवी तेथी ते अबोह छे अने अंतरंग निवृत्ति छतां पायु द्रव्याकृतरे ज्ञ उपकरण ईद्री परावात पानी जाय तो पठार्यनुं आज्ञानपछुं प्राप्त याय छे तेथी तेमां लेद पायु छे. उपकरण द्रव्येंद्री पायु बाह्य ने

ઈદ્રિય સ્વરૂપ.

૩૧૭

અભ્યંતર એ પ્રકારની છે. તેમાં ખાદ્ય ઉપકરણું દી માંચ્ચપેશીરૂપ સ્થુળ અને અભ્યંતર ઉપકરણું દી તેમાં રહેલી શક્તિરૂપ સુદૂર જાણ્યી.

ભાવેદ્રિયના પણ એ પ્રકાર છે. ૧ લગ્નિધ ભાવેંદ્રી ને ૨ ઉપયોગ ભાવેંદ્રી.

૧ કષ્ટાદિકા વિષયવાળો તે તે પ્રકારના આવરણનો જે ક્ષેપણા તે લભ્યરૂપ ભાવેંદ્રી.

૨ ગોત્પોતાની લગ્નિધને અતુસારે વિષયોને વિષે આત્માનો જે બાપાર તે ઉપયોગરૂપ ભાવેંદ્રી. કુંડામાં શક્તિરૂપ લગ્નિધ ઈદ્રિય અને તેના બાપાર રૂપ ઉપયોગ ઈદ્રિય.

લગ્નિધરૂપ ભાવેદ્રિય સમકાળે પાંચ વર્તે અને ઉપયોગ ભાવેદ્રિય તો એક કાળે એક જ વર્તે-વધારે ન વર્તે. એટલે જે ઈદ્રીની સાથે પ્રાણીનું મન જોડાય તેજ ઈદ્રી પોતાના વિષયને થહુણ કરવામાં પ્રવત્તે. આ સંખ્યામાં કેટલીક વખત પ્રાણીને પાંચ ઈદ્રીને સમકાળે ઉપયોગ હોનાનો ભ્રમથાય છે. જેમને શાખ કરતી (કડ કડ ગોલતી), સુગંધવાળી, સુકોમળ, લાંખી અને સ્વાદીષ શાફુલી¹ને ખાતાં પાંચ ઈદ્રીઓના વિષયનો ઉપયોગ વર્તે છે એમ સમજવામાં આવે છે; પરંતુ તેવો ભ્રમ થવાનું કરણું મન નુહી નુહી સર્વ ઈદ્રીઓની સાથે એટહું ખંબું શીશ્વપણે મળે છે જે જી છુટું પડે છે કે તેના અત્યંત વેગને લઈને પ્રાણીને નુહો નુહો કુમસર બોધ થતો જણ્ણાતો નથી. પણ સમકાળે બોધ થવાનું સમજાય છે. જેમ અતિ કોમળ એવા કમળના સો પત્ર ઉપરાઉપર ગોડવેલા હોય તેને સુવાન માણુસ તીવ્ર સોચવણે એકદમ વીધી નાણે છે, તેમાં જે એક ધીજ પત્રનો કુમસરજ વેદ થાય છે છતાં માણુસ સમકાળે સો પાન વીધી નાખ્યાનું માને છે તેમ અહીં પણ જીમજાયું.

અરિદ્ધાંતને પણ સમકાળે જે ડુંગ્યોગ વર્તતા નથી તો છબ્બન્યને પાંચ ઉપયોગ શી દીતે સમકાળે સંભલી શકે? સંભલેજ નહીં. પરંતુ આત્મા મન જાણે, મન ઈદ્રી જાણે અને ઈદ્રીપોતાને ચોઝ્ય પદાર્થ જાણે એવા શીશ્વપણે જોડાય છે કે તેની ખંબું પડી શકતી નથી. મનનો વેગ તો એટલો બણો તીવ્ર છે કે તેને કાંઈ પણ અગ્રભ્ય નથી અને જ્યાં મન વય છે ત્યાં સાથે આત્મા પણ જ ન છે.

જીવનો એકાંદ્રીય, જે ઈદ્રિય, ચૌરાંદ્રિય ને પંચાંદ્રિયપણુનો, જે બનહાર છે તે દ્રવ્યાદ્રીયને અપેક્ષાને છે. એમાં ભાવેંદ્રી તો બહુતાદિ વૃદ્ધોમાં પાંચ દેણાય છે; પરંતુ તેને દ્રવ્યાદ્રી એકજ હોવાથી તે એકાંદ્રી કહેવાય છે. (આ વિષય વનસ્પતિમાં જીવત્વવાળા વિષયમાં વધારે સ્પૃહ કરેલ છે.)

૧ રહેલી કરવા માટે લાંખી કરેલી સકરલકડી.

पांच ईद्रियोनुं जडापालुं (स्थूणाना) अंगुष्ठाना असंभ्यातमा भाग केटलुं होय छे. अहीं कोहि शंका करे के-“स्पर्शद्विद्य जे अंगुष्ठाना असंभ्यातमा भाग नेउवी ज तारी होय तो खण्डाहिना बात लागे छे, त्यारे तेनी वेदनानी अतु-लब ढेहनी आंदर पछु थाय छे ते के उम थर्फ शके ? आनो उत्तर ये छे के-स्पर्शद्वितीय विषय शीताहि स्पर्श छे, चक्र ईद्रीनो विषय रूप छे, ग्रांडूटीनो विषय सुग्रथुर्गध्य छे, पछु तेनी वेदना तेनो विषय नथी. वेदना तो हँगना अनुभवहृप छे अने तेने तो आत्मा ज्वराहिक्नी वेदनानी जेम आणा शरीरे अनुभवे छे. धीने अश्व येम इत्यामां आवे के ठुंडु पाणी पीतां तेनी शीताहिनो अनुभव उत्तीक वपत आंदर पछु थाय छे तेनुं शुं कारखु ? तेनो उत्तर ये छे के-स्पर्शद्वितीय तो जेम खदार वर्ते छे तेमज आंदर पछु सर्व अंगना प्रदेशमां वर्ते छे. परंतु आंदर ने खडार पर्यंत लागे तेनी जडार्थ तो अंगुष्ठाना असंभ्यातमा भाग नीज छे.

हुये पांच ईद्रीयोनी^१ खडालाई^२ कहे छे-श्वाय, ग्राणु ने चक्र ईद्रीतुं पूरुत्व अंगुष्ठाना असंभ्यातमा भागनुं छे, रसनेंद्रियनुं पूरुत्व अंगुष्ठा पृथक्त्व (जे अंगुष्ठायी नन अंगुष्ठा) छे अने स्पर्शनेंद्रियनुं पूरुत्व चापतिपाताना ढेह प्रभाषु छे. स्पर्शद्विद्य शिवाय आडीनी चार ईद्रियोनी खडालाई आत्मांगुणे समज्वी अने स्पर्शद्वियनी खडालाई उत्सेध अंगुणे समज्वी. अहीं कोहि शंका करे के-“ न्यारे शरीरसुं प्रभाषु उत्सेध अंगुष्ठावडे इत्यामां आवे छे त्यारे तेमां रेहवी आडीनी चार ईद्रियोनुं अभाषु पछु उत्सेध अंगुष्ठावडे ज करुं जेहुओ. उमके शरीरसुं उत्सेध अंगुणा ने बीजु चार-ईद्रीयोनुं आत्मांगुणे प्रभाषु कर्वुं ते थोर्य लागनुं नथी.” अनो उत्तर ये छे के-अे जुङ्हा विजेरेनी खडालाईमां उत्सेध अंगुष्ठा वाईत्यो तो वसु जाउ उत्कृष्टा मनुष्य शरीरमां ने छ जाउ उत्कृष्टा पछु शरीरमां तेना विषयनुं ज्ञान ज थेहे नहीं. करणुडे अवला मोटा शरीरमां उत्सेध अंगुष्ठावडे नव अंगुणा प्रभाषु उत्कृष्टा मानवाणी आंतर निर्वितिरूप रस-मंद्री जे पछु मोटा शरीरना प्रभाषुमां दोही ज्ञेयत्वे तेनी मोटी जुङ्हानी आंदर व्यापी ज शक्ये नहीं. अने तेथी आणी जुङ्हाने रसनो गोष थर्फ शक्ये नहिं. भाटे तेनुं प्रभाषु आत्मांगुष्ठावडे ज समज्वुं. गंधार्दिनो व्यवहार पछु आत्मांगुष्ठावडे ज समज्वये.

हुये पांच ईद्रीयो ज्वन्यथी योतपेताना विषयने डेट्वाहूरथी अदबु करे ते कहे छे-चक्र विना आडीनी चार ईद्रीयो अंगुष्ठाना असंभ्यातमा भागरी योतपेताना

१ आ खडालाई अभ्यंतर निर्दिनिरूप द्रव्य ईद्रीनी जडुवी. २ झुक्का.

વિષયને અહણું કરે છે, અને ચાલુ અંગુળના સંઘાતમા ભાગથી અહણું કરે છે. તેજ ઠારણથી ચાર ઈદ્રીઓને વ્યાંજનાવચઙ્ગ છે ને ચક્ષુઈદ્રીને નથી. અહીં નવા શરાવલાનું હૃદાત ગાપેલ છે કે-નેમ નવું (કોડું) મારીનું પાત્ર એક પાણીના જિંહુથી આર્દ્ર થતું નથી; પરંતુ વારંવાર ધારું ટીંપાં અવિનિષ્ટભાષણે પહોથી આર્દ્ર થાય છે; તેમ સ્ફોદો (ઉધોતો) માણસ એક શાણ કરવાથી જગી જતો નથી, પરંતુ પાંચ સાત શાણો ઉપરાડિપરી ઠાનમાં પડવાથી શાણદ્રવ્યવડે ઠાન ભરાયે સતે તે જાગે છે. એ પ્રમાણે વ્યાંજનાવચઙ્ગની જાવના સમજુ લેવી.

ચાલુ અપ્રાયકારી હોવાથી ગાંગુળના સંઘાતમા ભાગ હુરુણોથિયારે પોતાના વિષયને અહણું કરી શકે છે; પણ તેથી નશુક હોય તો અહણું કરી શકતું નથી. અલ્યાંત નશુક એવું આંખમાં આંખેલ અંગન કે આંખમાં પડેલ તૃણ વિગેરને ચાલુ જેઠ શકતા નથી. આ વાત સાં જણે તેથી છે.

હુંવે વધારેમાં વધારે કેટકા હુરદ્વી આવેલા પોતપોતાના વિષયને ઈદ્રીઓ અહણું કરે ને કહે છે. ઠાન બાર ચોજનથી આવેલા શાણને સાંખળી થકે છે, ચક્ષુ આધિક લાખ ચોજન હુર રહેલા પોતાના વિષયને અહણું કરી શકે છે; અને બાદીની નશુક ઈદ્રીઓ નવ નવ ચોજનથી આવેલા પોતપોતાના વિષયને અહણું કરે છે. આ પ્રમાણે પાંચ ઈદ્રીઓનો ઉત્કૃષ્ટ વિષય છે. અહીં કાંઈ શાંકા કરે કે “ચાલુ વિનાની ચાર ઈદ્રીઓ તો પ્રાયકારી છે તો પછી તમે કહેલા પ્રમાણું ઠરતાં હુરદ્વી આવેલા વિષયને પણ અહણું કરવામાં તેને અહયણ જણુંતી નથી; તેથી તમે બાર ચોજન વિગેરનું પ્રમાણું આંખું તે નિષ્ઠળા જણાય છે; કારણુંકે તેનામાં તો પ્રાય અંધનાળા સર્વ પદાર્થના વિષયને અહણું કરવાની શક્તિ છે; તેને નશુક કે હુરદ્વી આવેલા સાથે કાંઈ કંણાંધ નથી.” અને ઉત્તર એ છે કે-શાણદાહિના પુદ્ગળો કે ઉપર કહેલા પ્રમાણું ઠરતાં વધારે હુરદ્વી આવે તે અભાવેજ એવા મંહ પરિણામવાળા થઈ જય છે કે તે પોતપોતાના વિષયનું જાન આપવાની શક્તિવાળા રહેતા નથી, તેમજ ઈદ્રીઓમાં પણ સ્વભાવેજ તેઓને અહણું કરવાની શક્તિ નથી; તેથી ચાર ઈદ્રીઓને પ્રાયકારીપણું છતાં પણ ઉપર કે વિષયનો નિયમણતાવ્યો છે તે ચોણ્ય છે. ચાલુમાં પણ તેના વિષયથી હુર રહેલા દ્રવ્યને જણવાની શક્તિ ન હોવાથી તેને માટે બાંધિદો નિયમ પણ ચુક્તા છે.

જીવદા, નાશિકા ને સ્પર્શદ્વિદ્ય ગાદુસ્પૃષ્ટ દ્રવ્ય અહણું કરે છે, કણું રસ્પૃષ્ટ દ્રવ્યને અહણું કરે છે; અને નેત્ર અસ્પૃષ્ટ વસ્તુને આહણું કરે છે. આત્મ પ્રદેશોએ આત્મદ્રવ્ય કરેલું તે બાદું કહેવાય છે. અને શરીરપર રજની પેઠે કે ચાંદેલું

होय ते स्पृष्ट क्षेत्रवाय छे. अर्ही कोई शंका करे के—‘आरे ईद्रीज्ञाने आपेक्षारी पर्युष के तुच्छ छे तो परी तेमां आवें तक्षावत शा गाए ज्ञेयः?’ तेनो उत्तर अे छे के—स्पर्शी, गंध अने सभ चांगडी द्रव्यसमूहानुः शण्डद्रव्यनी अपेक्षाये अवपपर्युष, धारदरपर्युष अने तुरत अभावुकपर्युष छे; तेमन्न स्पर्शीद्विय, नाशिका ने शुब्लानुः कर्णी करतां मांद शक्तिपर्युष छे तेथी ते गद्वस्पृष्टनेन बदलु करी शके छे. अने स्पर्शीद्व द्रव्यसमूहानु अपेक्षाये शण्डद्रव्यनी सांखति घण्ठी छे, सूक्ष्म छे अने नशुक रेत्वा शण्डयोग्य द्रव्यने अविवासित करनारी छे. तेथी ते निर्वृत्ति ईद्रीनी अंदर ज्ञाने हार्षी करतां न स्वगोचर अभिव्यक्ति तत्काळा करे छे; वणी औलु ईद्रीज्ञानी अपेक्षाये कर्णी पटु शक्तिवाणा छे; तेथी ते स्पृष्ट द्रव्यने बदलु करी शके छे.

केटवाक चक्रुने पर्यु स्पृष्टार्थ आदिपर्यु कर्णे छे, यथा ते आशुक्ता छे. आरण्य के ज्ञ तेम होय तो अधिने देखतां चक्रुन दाढ अवें ज्ञेयः. तेमन्न काच्चना पावरमां रेहती वस्तुओ अने जणा द्वार्थी देखाय छे तेनो ज्ञ नेवने स्पर्शी यतो होय तो अथवा नेव तेन बेहीने तेमां जणा होय तो जणनो आव थध ज्ञेय ज्ञेयः. तेम थतुः नथी तेथी चक्रु अस्पृष्ट अर्थनेन बदलु करे छे अम सिद्ध थाय छे. आ सांगंधमां वधारे युक्ति प्रयुक्ति जायवी होय तो स्वाक्षादरत्नां करावतारिका अथवी नाली लेवी.

उपर केटवे द्वार्थी आवेदा पोतपोताना विषयने ईद्रीज्ञा बदलु करे छे ते संघंधमां के मान कह्युः छे ते आत्मांगुणो बाणवुः; केमके ज्ञ ते मान प्रमाणांगुणो होय तो आ काणे घुङ्गु वधारे थध पदे; तेटवा द्वार्थी आवेदाने योध थध शके नहीं, अने ज्ञ उत्सेधांगुणो ते प्रभाण ईद्रीज्ञे तो भस्तव्यकीना वारामां तेना आत्मांगुणवडे बार योजन लाणी न नव योजन गाणुणी अवेद्या विजेते नगरीज्ञामां एक ज्ञायांगे वगाडेवी लंबा आणा शांखरमां संभाणाती हुती ते संभागाय नहीं. तेथी ते मान आत्मांगुणानुन बाणवुः. अर्ही कोई शंका करे के “आत्मांगुणानु ते प्रभाण एहेयो तो लाण्या योजनना प्रभाणवाणा देव विमानमां एक ज्ञायांगे करेवा धंयानो नान चर्वीन तेम संभाणाणे? भाए आत्मांगुणे पर्यु ते मान धरी शांखतुः नथी.” आ शंकाना युवासामां श्रीरायपसेषी सूतनी टीकामां सूर्योक्तदेवना अधिकरमां कहेकुँ छे ते ध्यानमां बोवानुः छे. ते अे छे के “मेवना स्वर नेवी गालीने भवुर शांखवाणी अने एक योजनना वेरावावाणा सुस्वरा

१. अत्मांगुण, प्रभाणांगुण ने उत्सेधांगुणुः स्वरूप लाभप्रकाशाहिता। नाली लेवुः.

ઇંગ્રિય રહણ.

ઉત્તે.

તામની ઘંટા વગાંધે સતે સૂર્યોઽચ વિમાનની બિંંતોપર તે શાખ પુદુગળો પહોંચી રેમાંથી ઉછેલોતા તે ઘંટાના લાગો પ્રતિશાદો-પઠઘંટાઓથી તે આણું વિમાન વાસ થઈ ગયું. અથોં હેવાભાવથી અને દિશાઓને વિદ્યાઓમાં તેના પઠઘંટાઓ વિસ્તરી જવાથી અનેક લાખ ચોનજનના પ્રમાણનાનું તે વિમાન ખેણું થઈ ગયું. "આ પ્રમાણે હોવાથી અત્માંશુદ્ધાંગડે ઈંગ્રીચેના વિષયોનું હરસાણું" માપવાનું કલ્યું છે તે ગરાણર છે એમ સિદ્ધ થાય છે.

હેવે નેત્રના વિષય પરતે જાવિશેય હકીકત કહે છે-પુષ્ટરવર દ્વારાવાસી મનુષ્યો પૂર્વે અને પદ્ધતિમે ૨૧૪૪૫૭ ચોનજન હરસથી સૂર્યને જોઈ શકે છે. આ પ્રમાણે ત્વાં રહેનારા મનુષ્યાહિકના નેત્રનો વિષય હંદેલો છે. ને ગાંધી તો સાધિક લાખ ચોનજન હરસાણું ઉદ્ઘટ જેઠ શકે એમ કોહેવામાં આવે છે તો તેમાં વિસંવાહ કેમ ન આવે? તેનો ખુલ્લાસો એ છે કે—“નેત્રનો વિષય લાખ ચોનજનનો જો હંદેલે છે તે અભાસવર એવી પર્વતાદિ વસ્તુઓની અપેક્ષાઓ જાણુંબો.”^૧ ભાસ્વર એવા સૂર્યોહિની અપેક્ષાઓ તેનાથી અધિક પણ હોય છે.”

આ ગાંધીની ઈંગ્રીચેના અનંત પરમાણુઓની અનેલી છે, અને દરેક ચસંખ્ય આકાશપ્રદેશાવગાહુવાળા છે; તેમાં સર્વથી એણા અવગાહવાળી ચકુદ્ધી છે, તેનાથી સંખ્યાતગુણું અવગાહવાળી ઓચેંદ્રી છે, તેથી સંખ્યાતગુણું અવગાહવાળી ગ્રાણું દ્રી છે, તેનાથી અસંખ્યાત ગુણું અવગાહવાળી જીવણ છે; અને જીવણથી સંખ્યાત ગુણું અવગાહવાળી સ્પર્શેંદ્રી છે. એટલે એ પ્રમાણે વધારે વધારે આકાશપ્રદેશોને તેણું રોકેલા છે. સર્વથી સ્તોક પ્રદેશવાળા નેત્ર છે, તેનાથી સંખ્યગુણાધિક શ્રોત્ર છે, તેનાથી અસંખ્ય ગુણાધિક શ્રાણ છે, તેથી અસંખ્ય ગુણાધિક જીવણ છે અને તેથી અસંખ્ય ગુણાધિક પ્રદેશવાળા સ્પર્શેંદ્રી છે. આ પ્રમાણે તેના અવગાહને પ્રદેશોનું અવસ્પષ્ટહુલ્લ જાણું.

ઓન એ, નેત્ર એ, નાસિકા એ, જીવણ એક ને સ્પર્શન એક-એમ દ્રવ્યેંદ્રી આદ છે ને ભાવેંદ્રી પાંચજ છે. સર્વ જીવોને સર્વ જાતિપણે અતીતકાળ સંખ્યી દ્રવ્ય ને ભાવદ્રીએંચા અનંતી હોય છે. તેમાં અનાદિનિઃદેને તો સ્વજાતિપણે પણ અતીત ઈંગ્રીચેના અનંતી હોય છે. અને એ જીવને નિગોઠમાંથી નીછજ્યા અનંતો કાળ થયેલો હોય છે; તેને સર્વ જાતિપણે અતીત ઈંગ્રીચેના અનંતી હોય છે. અનાગતકાળ સંખ્યી વિચાર કરતાં તદ્દબ્ર મૌદ્ધ્યગામી જીવોને અનાગત

^૧ પોતાના વિકુલેલા લાખ ચોનજનના શરીરની અપેક્ષાઓ પોતાના પગના અણુંડા દેખતા હોવાથી એકલો વિષય જાણુંબો એમ પણ કહેણું છે.

ઈंद्रीञ्चा हेतीज नथी. अने केटलाड लुबोने पांच, ७, आत, संण्याती, असं-
भाती अने अनांती होय छे. आ अनागत ईंद्रीञ्चा संबंधी विचार श्री लोक-
प्रकाशादि वंशाथी जाणुवा घोष्य छे. आगे ते अप्रस्तुत होवाथी कहेल नथी.

संजी पंचाद्विय लुबोने नमुलाहि ज्ञाननां साधनबूत मन होय छे. ते
नेष्ठाद्विय कहेवाय छे; तेना पछु द्रव्य ने लाव अभ ऐ बेह छे. मनपर्योगिनाम
ठर्मना उहयथी मनने योज्य अभी पुढ़गाप वर्गलाङ्गोने ब्रह्मण् ठर्मने मनपर्यो-
गिन्युमाववामां आये छे, ते द्रव्यसन कहेवाय छे; अने मनोद्रव्यना अवलं-
णनथी मननी के परिणुति याय छे, ते लावसन कहेवाय छे. अमां द्रव्यचित
विना लावचित न होय अभ समज्ञुः खुच्चा असंजी लुबोने मनपर्योगि
न होवाथी द्रव्यमन नथी अटखे तेने लावगत पछु नथी. लावमन विना द्रव्य
मन होय छे. केमडे निनेश्चने डेवगज्ञान पास्या परी लवस्य होय तां सुधी
लावमन होतुं नथी, पछु द्रव्यमन होय छे. सिद्धावस्थामां ते पांत नथी.

सर्वथी योआ लुबो मनवाणा, तेथी असंप्युत्यु आववाणा, ते करतां चक्षु,
ग्रासु ने रक्षनावाणा अविक अविक, तेनाशी अनिद्रिय लुबो (सिध्दो) अनंत-
गुच्छ अने तेनाशी स्पर्शनिद्रियताणा अनंतगुच्छ जाणुवा.

सुश्रुत विजेत्रमां चक्षु, आव, ग्रासु, रक्षना, त्वक्, मन, वाचा, वाणि (हाथ),
पर, शुद्ध ने उपस्थ अभ अज्यार ईंद्रीञ्चा कहेली छे, ने नाममाणामां स्पर्श-
नादिक्ते षुद्धीदिशे अने हाथ पर विजेत्रे द्वियंदिशे कहेली छे.

आ प्रमाणे ईंद्रीञ्चान् अदृश्य गराणार ज्ञानीने तेनो सहपर्योग करवा तत्पर
थवुं; तेनो हुड्पर्योग करनार ग्राणी हुर्गतिं लाय छं, आं सहपर्योग करनार
प्राणी सहृगतिनुं भाजन थाय छे. आपलुं के आ लेगनुं रहस्य छे तेने अंतःक-
रमां डेही राणपुं के जेथी जननंतरमां हुःगनुं भाजन थवुं न घं; अने सर्वन
सुअन्नी प्राप्ति याय. ने परिणुमे-ऐवटे गःजरामर पदनी प्राप्ति पाणे थाय.

तथास्तु.

विचार तेवुं परिणाम.

- १ तमारा आनंदमां तमे वृद्धि इच्छेहो; ऐटले तमने ते वधारे भाग्यो.
- २ आपणा हुःअनो माटो लाग “आपणे केटला अथा हुणी छीये” तेवा विचारस्थी ज उत्पत्त थाय छे.
- ३ जेम केम एड नणाहाई अथवा झोटा कार्यना तमे वधारे विचार करेहो तेम तेम वधारे द्रवताथी ते तमने वणगशे.
- ४ न्यारे तमने श्रम लाग्यो होय लारे तमे केटला अथा याढी गया छो तेनो विचार कर्या करेहो तो तमे वधारे श्रभित थशो.
- ५ जे मनुष्यो हैड क्षेणु “हुं केटलो अथो नाणो थध जये छुं” तेवा विचार कर्या करे छे ते वधारे नणाहा थता नव्य छे.
- ६ मनमाने शरीरमां के कोई आणत तरइ तमे लक्ष घेऊ छो अने विचार करेहो ते आणत वधारे द्रढ थती नव्य छे.
- ७ छांडगीमां के उत्तम कार्यी कर्या होय अथवा अन्य मनुष्याचे करेला अनुभव्या होय तेना केम केम तमे वणाशु करेहो अने वारंवार तेनो विचार करेहो तेम जेन तेनाथी वधारे उत्तम कार्यी करवा तमे प्रयत्नशील अनेहो-तमाड़ लक्षतेवा उत्तम कार्यी तरइ होराशे.
- ८ केम केम ‘सद्गुणी थवुं’ ते केवुं उभदा अने इच्छवा लायक छे’ तेनो तमे विचार करेहो तेम तेम सद्गुणसंपन्न थवा वधारे घेऊयता तमे प्राप्त करेहो.
- ९ तमारा शरीरना के कोई लाग्नी भजभूताही माटे तमे वारंवार विचार करेहो ते भाग्यनुं वाण तगे गेवहुं करी शकेहो.
- १० न्यारे कोई पणु आणतथी तमे नाराज थथा हो, त्यारे केम केम तेना ताराजु भाए तमे वधारे अने वधारे विचारेहो तेम तेम तमे वधारे नाराज थशो.
- ११ तमारा सद्वासीमाना हुर्शिणो तरइ जे तमे वारंवार लक्ष घेऊयेहो तेनो विचार कर्या करेहो तो ते हुर्शिणोनो तमारामां प्राहुसीव थतां वार लागेहो नहिं; माटे तमारा सद्वासीमाना सद्गुणु तरइज लक्ष घेऊयेहो अने तेने माटे ज वारंवार विचार करेहो.
- १२ जे तमाड़ नशील तमने साड़ लागतुं न होय तो “हुं अराण नशीणवाणो छुं; मारी आशा चांपूलू थतीज नथी” तेवा झोटा अने नकामा विचार करवाथी तमने अनिष्टनीज प्राप्ति थया करेहो; माटे झोटा विचारेथी भगाजने भरवानुं भूती जध सुविचाराज सेवने.

३२६

ज्ञेनधर्म प्रकाश.

हती. तेमणे काम धारुंज संतोषपादक अनन्युं हतुः. मंटपनी आंदर पाणु रा. २।
आमुलभराय छग्नलाल विगेचे गृहस्थाने ते व्यवस्था सेंपवामां आवी हती. ७५-
८० रात ४० ने तमाम णांदोणस्त अंतोषपादक हतुः.

मंटपनी आंदर कमली बालु आदार गामना उवीजेटो, ताणी बालु अभ-
दावाद शेषेना ऐवीजेटो, सामे प्रमुण ज्ञाहेण अने वारीवट करनार अतिनिधिच्यो
अने तेमनी पाठ्य स्थानिक प्रतिनिधिच्योनी ऐक राणवामां आवी हती. पाठ्याना
लागमां वीजीटो. माटे ऐक हती. तेमने पाणु टीकीटो आपवामां आवी हती.
अमदावादना संघमांथी सुमारे ५०० उवीजेटो हरवावामां आव्या हता; परंतु कोई
पाणु वर्षत भत लेट थयेन नहुतो ते नेथी भतो गाण्यावानी ज्वर घडे. तमाम
दरणास्तो अने हरवो खर्वानुभतेन पसार करवामां आव्या हता.

प्रारंभाना शनिवारनी अपोरना एक क्लाउ नगरशेठ कुस्तुरसाई भण्य-
लाई पधास्तां तेमने ताणीच्याना अवाक्षी वधावी लेवामां आन्यां हतां. प्रमुण
नथान तेमने आपवामां आव्युं हतुः. आढ प्रारंभाना नामदार वाईभराय लोई
हाडीने हीडी आते कोई बदमसे भारेला योग्याना संघंधगां दिलिगिरी न्वहेर
करवानी दरणास्त प्रमुण चालेण रक्तु की हती, अने त्यारभाद सरदार शेष लाल-
भाई हलपतक्षाई अने नगरशेठ चीजनवाई लालभाईना थयेदा अत्यंत
गेहडारक भरवु संगांधी दिलिगिरी प्रहर्षित करनारी दरणास्तो मुक्तवामां आवी
हती. त्यारभाद ने खालिकाच्यो नीचे प्रमाणे मंगणाचरवु कर्युं हतुः.

राग सारंग.

अदा शुका मंगणभय भद्रावीर,

जोतम गाण्यधर द्वीर. सदा शुक्ल० चो टेक.

स्थूलबद्रादि मादा मुनि मंगणा, आगर सम यंकीर.

सदा०

ज्ञेनधर्म सङ्ग मंगणकारी, तारे लवज्ञा नीर.

सदा०

दायक हिं अनिष्ट निवारक, गोयम वीर वशुर.

सदा०

आंगुडे अमृत लिंगवर, अप्रतिष्ठ यमीर.

सदा०

कुर गो तडे भण्य हाला ऊतम, पापपंडदर नीर.

सदा०

भद्रा मंगण शीशंथ सक्ता शिर, “नमो तीर्थस” लंगे वीर.

सदा०

ते श्री संव चरणकूर नामे, सांकणाच्यंह निज शीर.

सदा०

हुरिगीत छांद.

श्रीसंघने बुर नमो तीर्थ क्षेत्र असु आवडाहमां,

ते संघ लास्तवर्षना शुल मज्यो अमदावादमां;

अमहावाह आरे भगेलो श्री संघने महान् भेगावडे.

३२७

समुदायमांथी शोधी प्रतिनिधि तीर्थगेडी उद्देशे,
श्रीसंघ प्रतिनिधि संप संपी तीर्थनुं रक्षणु करो.

१

पंजण ने णंगाण गुर्जर कठ्ठ मङ् भेगावडी,
श्रेताभणदा भलाराघड मुंबई हिंद काडियावाडी;
श्रीसंघ परिपदमां पवारी प्रेमर्थी सनगन नरो,
श्रीसंघ प्रतिनिधि संप संपी तीर्थनुं रक्षणु करो.

२

गत तीर्थ वाणो आणु पाणो जिनागमनी सर्वदा,
जिनभुवन शुल्कोद्धार ज्ञानोद्धार करी व्यो संपदा;
नरसन अने परवत युधारो विजय वसुधा विस्तरो,
श्रीसंघ प्रतिनिधि संप संपी तीर्थनुं रक्षणु करो.

३

ठांच गोंचताणु न कीलुमे भत हीलुमे भळाशय घरो,
निज भुद्धिणापतन मन अने धन भातुभावे वावरो;
शुभ छांच संकुण्यां ह क्षेत्री णांच खांचे पाधरो,
श्रीसंघ प्रतिनिधि संप संपी तीर्थनुं रक्षणु करो.

४

मंगणाचरणु थई रद्या णाढ शेंड आणुहेणु कव्याख्याती ऐडीनी व्यवस्थाने
अंडे अने १८८०मां दीतसरतुं खांचरणु करवामां आण्युं ते वणते वहीवट करनार
प्रतिनिधिओने के स्थितिगां वहीवट सोंपवामां आव्यो होतो तेतुं सर्वेयुं संवत
१६६६नी आण्यर सुधीनुं वाचवामां आण्युं हतुं, अने व्यारपछीना दरेक वर्षना सं-
वेयांत्यार राखेलां होतां छतां वधारे वणत न ज्यतेटला माटे संवत १६६६ ने
दृष्टी आणसना सर्वेयां वाचवामां आव्यां होतां. संवत १६६६नी आण-
स्तुं सर्वेयुं त्यार थेले न छावायी वाचवामां आण्युं नहेतु. वाचेला सं-
वेयानो सार ए होतो के—“ अने १८८०मां एटले संवत १६६६नी आणरे सुमारे
आण्यार लाभनी भीडकत सोंपवामां आवी होती, ते संवत १६६७नी आणरे
उप थी उद लाभ केटकी थई होती एटले एकहर स. १६६८ शालनो वधारो
गलतां रप थी २६ लाभ केटको वधारो थेणे होतो ” अने एवटना संवेया उपरथी
जपातुं हतुं के “ तमाम श्रीलीक ग्रामीचारीदोन अथवा सधर नमीनगीरीवाणी
एकमांक शाकवामां आवी होती. औज डोऱ्य पण आतामां के डोऱ्य पण भीलमां
के डोऱ्यने खेणु आंग डधार गापवामां आवी नथी एटले ते संबंधमां एलाती
आइवा तदन गणत होती एम जणाशुं हतुं.” उपर ग्रमाणेनां सर्वेयां विग्रे
वाचवाथी श्री संघने घेणु अंतोप थेणे होतो.

सर्वेयां वाचाई रवा याह आ पैदीनी व्यवस्थामां के काँઈ देवदार करवा लायक नशुय ते लाणी मैडवता माए आणा दिहुस्थानमां चुहा चुहा यामो ने शहेरेना संघ उपर सांच्यागांध कागणो शेइ आणुंदलु कव्याषु तरक्की लणवागां चाव्या इता, अने ते साथे अने १८८० ना प्राज्ञींगनी छपिवी नक्क मैडवता मां आवी इती. ते उपरथी आवेदा युमारे १८८० उपरांत गामेना पत्रेमां के ए देवदार अने सुधारा वधारा ज्युतवामां आवेदा इता ते तगाचारी तारवणी कीने हरेक भावतमां टेटवा ग.भ तरक्की अविचार भताववागां आवेदछे तेनी सांच्या भताववामां आवी इती.आ तारवणी बहु संस्कर करवामां आवी इती.आमां पाण धोणा वणत गयो इतो. करण्डे अंडे गामनी केाध नवी दरणास्त छाय तो ते पाण नशुववामां आवी इती.

आ तारवणी वाचाई रवा याह तेमांथी प्रथम कई दरणास्त छाय धरवी तेनी चर्ची चाली इती; तेने परिणामे प्रथम दरणास्त स्थान मुक्कर करवानी गुणवी ज्ञेये अम इतां शेइ आणुंदलु कव्याषु युमारे अमदावाह आते कायम दाखवी के केम? ते संघधी दरणास्त मुक्कवामां आवी इती.

शा. कुंवरलु आणुंदलु श्री भावनगरवाणां दरणास्त करी के-आप साहेबांनी समक्ष सं. १८८८ थी सं. १८९७ युधीतो ले लीकाण अने सर्वेयुं रत्नु करवागां आवेदछे ते उपरथी आप चाहेगे ज्ञेइ शक्या थो ते प्रारंभमां शेइ आणुंदलु कव्याषु युमारे भीडकत ने इती तेमां सं. १८८८ नो वधारे ज्युतां युमारे २४-२५ लाग केटवो अे अस्सामां वधारो थयो छे अटखे के अने १८८० मां ११ लाप्प लगलग गीडकत इती, ते सं. १८८८ नी आणरे ३५-३६ लाप्प लगलग थण्डव छे. आपगें मात्र द्रव्यनी वृद्धिधी लवचाई ज्वानुं नर्थी; परंतु अडेक वर्षमां सो सो वणत मेनेलांग इन्द्रीयां भीटिंग लीने आहुना वडीपट करनार प्रतिनिधि साहेबांने शेइ आणुंदलु कव्याषु युमारे भीडकत लागवाना तन, मन, धनमो लोग आणेहे छे, अने आपसु तीर्थना देके वेटवा अनी शक्या तेटवा जागव्या छे अने तेने भाए पूर्तो प्रथल क्षीरो. के भाजु आवुं अतोपकारक काम ३२-३३ वर्ष केटवी लाणी मुहत सुधी कर्वुं छे तेमानज छायमां आ पैदीतुं काम कायम राणवुं अ हरेक दीने चेत्य ज्युताय छे, ते इतां अक वार तकरासनी आतर नहीं पाण संतोष पमाहानी आतर आगांगु आ पैदी गाढीयी ज्येती थीने लाई ज्वाना विचार पर आवीये, पाण न्यां सुधी काँઈ याव शहेरेना संघना आजेवानो अंडेव थधनि-अंडे विचारधी-अंडे तीतधी तेवा प्रकाशनी गागली आपली अटखे आणा दिहुस्थानना अने गेवा श्री संघनी अमक्ष रव्यु करे नहीं तां सुधी

અમૃતવાદ આતે ભગોદો શ્રી સંઘનો ગહાન મેળાવડો.

૩૬

આપણે તેવા ડરાવયર શ્રી રીતે આવી શકીએ? આ સંબંધમાં આજ સુધીમાં ધાર્યું છે, લખાયું છે, ગોવાયું છે, ડહેવાયું છે, પરંતુ તેના પરિણામ તરીકે ન્યારે આત્યારે કાઈ પણ માગણી આપણી પાસે રણું થતી નથી ત્યારે એમ માની શકાય છે કે આહીના પ્રતિનિધિ સાહેબોએ કરેલું કામ પૂર્ણ સંતોષકારક એ

એમ આપો શ્રી સંગ નિર્વિવાદપણે માને છે તેથી આપણે અહીં આતેજ પેઢી કાયમ રાણવાના વિચાર પર આવતું તેજ થોળ્ય છે, અને તેજ સજવર છે. તેથી આજ સુધી આહીના કે પ્રતિનિધિ સાહેબોએ ધાર્યું સંતોષકારક કામ કર્યું છે તે આતે તેમનો આબાર માનવાની આપણી ખાસ ફરજ છે; કારણે આત્યાર સુધીમાં તેઓ સાહેબે તન, મન, ધનના બોણ કામ કર્યું છે તેનો લાલ, તેતું માન તેઓ પોતે કેતા નથી, કેવા માગતા નથી, પરંતુ તેઓ શુદ્ધ અંતઃકરણથી એમજ કહે છે કે એમે કે કાઈ કરી શકાય છી એ અમારા ણણથી નહીં, પરંતુ શ્રી સંઘની સંહાયથી, તેમની મદદથી અને તેમની હુંદ્યથી કરી શકાય છી એ એટલે તેઓ કામ કરીને ગાન આપણુંને આપે છે, લારે આપણે તેમને માન આપવું જ જોઈએ. તે પણ એટલા માટે નહીં કે તેઓની ઉલ્લંઘન થાય; પરંતુ આવી રીતે કામ કરનારની શ્રી સંઘ તરફથી કદર બુન્નવામાં આવે છે તેથું જાહેરમાં આવવાથી તેમનો તેમજ હુંયે, પછી એંબો કામ કરવાની શક્તિ કે ઉલ્લંઘનતા હોય તેમનો ઉદ્ઘાસ વૃદ્ધિમાન થાય. સંગત એંબો સાહેબનો આબાર માનવા સાચે આપણું વિનાંતિ શા માટે ન કરવી કે તેઓ સાહેબે જ કેવી રીતે આજ સુધી કામ કર્યું છે તેવીજ રીતે પૂર્તા ઉત્તાલથી અને શ્રી સંઘને પૂર્ણ સંતોષ મળે તેવી રીતે કામ કર્યું. આત્મ વિચારથી હું દરખાસ્ત કર્યું છું કે “શેઠ આપણુંદળ કલ્યાણુંણની સુખ્ય પેઢી ને અમહાવાહ આતે છે તે ત્યાંજ કાયમ રાખવી.”

આ સંબંધમાં અભિગ્રાય આપતાં પહેલાં અભિગ્રાય આપનાર ગૃહસ્થીને હું વિનાંતિ કર્યું છું કે પોતે કે અભિગ્રાય આપવો તે તેતું પરિણામ વિચારિને જ આપવો, આપણે કે અભિગ્રાય આપીએ તેતું પરિણામ જે શુન્યમાં આવવાતું લાગે તો તેઓ અભિગ્રાય શા માટે આપવો? સંગત મારી કહેલી તમામ હુકીડત ધ્યાનમાં લઈને આપ સાહેબો પોતગ્યાતાનો ન્યતવ્ય અભિગ્રાય આપયો. પરંતુ હું આશા રાણું છું કે આપ સર્વ મારા વિચારને માગતા જ થશો. આટલું ગોવીને આપને દ્વારા વણત ન દરહાનો હું શેખી જવાની રૂણ લઈ શું.

આ દરખાસ્તને શેઠ કલ્યાણુંદળ શેષસાંગ્યાંદળ કંન કેન્દ્રસના રેઝિન્સ્ટ્રીન્ટ જનરલ સેક્રેટરીએ, દામોદર ભાપુરા એવલાડરે, રત્નામલાણ ગાંધી વરધીયાંદળનુંએ, સુરતવાળા શા. રત્નચંદ્ર પીમચંદ્રે અને પીળ વણા-

आज्ञे ठेका आप्यो हुतो अने दरभास्तु एक भाष विडूद गत शिवाय लीनु-
गते पसार थह छुती.

आ दरभास्तु पसार थया बाढ हुवे भयी क्या हरयो मुक्तवा ते
मुक्तर कर्वा माटे सणनेकट कमीरीना दृपमां एक कर्गीरी नीभवामां आवी हुती.
ते धनीर्ये रनिना ८ छाके भांडपमां भगवानुं उत्तवामां आव्युं हुतुं.
बाढ पहेला दिवसनुं काम अवास थयुं हुतुं.

रनिना ८ छाके हरयेली कमीरी भांडपमां भयी हुती, अने तेमां प्रथम
स्थानिक प्रतिनिधियो केटला कर्वा ? ने ध्यां क्यांना हरवात्वा ? ते भर थयो चाली
हुती. छेवटे ते आणतमां एक सध कमीरी नीभवामां आवी हुती; अने तेणु
जीन दिवसनी शेइकमां रीपार्ट रन्नु करवानुं राव्युं हुतुं. त्यारणाह जीन केटलाक
हरव मुक्तवाना मुक्तर करो कमीरी अरभास्तु थह हुती.

धीने दिवस.

भागशार वह ई. रविवार. ता. २५-१२-१२.

प्रभुभ साहेजे प्रभुभ रथान लीधा बाढ रावे निमेली सण कमीर्ये चोतानो
रीपार्ट रन्नु ध्यो हुतो. ते उपरथी पहेली दरभास्तु स्थानिक प्रतिनिधियोना
सांख्यामां वृद्धि कर्वा सांख्यी श्वा. कुंवरलु आयु-हलु ए रन्नु करी हुती.
तेमां केटलोक उमेरा थतां छेवट वर्हीपट करनार प्रतिनिधियो मुद्दां ११८ रथा-
निक प्रतिनिधियो नीभवानी दरभास्तु चर्नीनुभते पसार थह हुती. तेनी आंदर
मुख्य मुख्य नीचे ज्ञानेवा शहेरेना प्रतिनिधियो मुक्तर करवामां आव्यां हुता.

११ अमदावाद. ४ मुंगाठ. ४ मुरत. ३ लावनगर. ३ पाटलु. २ अंलात.
२ ऐडा. २ कलकता. २ मुर्शिदाबाद. २ जमनगर. आवी ८२ जामोना एकेक प्रति-
निधि उत्तवामां आव्या हुता. ते अथवा जामोना नामो द्ये भयीना अंडमां
आपवामां आवयो.

प्रथम स्थानिक प्रतिनिधियो उर हुता ते तमाम नामो जोउइ उत्तवामां
आव्या छे. अने त्यां त्यांना एक अथवा वायारे स्थानिक प्रतिनिधि उत्तवामां
आव्या छे त्यां त्यांना नामे इरी नीभीने भोक्तव्यानुं उत्तवामां आव्युं छे;
तेने माटे मुहत गर्यु भासानी उत्तवामां आवी छे. ते भावे नाथगायनी आंदर
नीभीने न भोक्ते तो तेनो हक लाय एंग उराव्युं छे.

अमदावाड भाते मणेलो श्री ज्ञानेना भडकन् भेगावाढे.

331

त्यारगांड पीठिं उंटलाएळे ठरावें वडीवट करनार प्रतिनिधिं सत्ता आण-
वाना संगंधना बुद्ध बुद्ध गृहस्थो तरक्षयी मुक्त्यामां आव्या हता; अने तेने टेक्हो
मणतां सर्वानुभते पसार करवामां आव्या हता, ते घण्ठा ठरावें हवे पाणीना अंकमां
आपवामां आवशे.

प्राते आडी रुहेला ठरावें मुक्तरर करवा भाटे गई काळे ठरावेली कमीटीच्या
आजे रात्रे पश्च मणवानुं ठरावी भीटींग दरणास्त थई हती.

राते ८ वारे नीमायेली कमीटी ओळन थई हती, अने तेमां वडीवट कर-
नार प्रतिनिधिआनी संग्या मुक्तरर करवा संगंधी चर्ची प्रथम आली हती. ते
संग्या नवनी मुक्तरर थया आढ धीन एक ऐ ठरावें छेवटना मुक्त्यानुं मुक्तरर
थयुं हतुं अने कमीटी दरणास्त थई हती.

त्रिज्ञे दिवस.

मागशर वाहि ७ सोमवार. ता. ३०-१२-१२.

प्रभुण स्थाने शेड कस्तुरसाई धीरान्त्या खाह वडीवट करनार प्रतिनिधिआनी
नीमनेक संगंधी दरणास्त ३४०. कुंपरण आणुंदण्णुचे रव्वु करी हती; तेनी
अंदर वडीवट करनार प्रतिनिधि तरीके नीचे जखुवेला ६ गृहस्थीने नीमवानुं
जखुव्युं लालुं.

नगररेठ कस्तुरसाई भणिशुभाई.	अवेरी वाडीलाल वर्खतचंद.
शेठ भनसुभसाई भगुलाई.	शेठ भणिशुभाई दलपतभाई.
शेठ अंबालाल साराभाई.	शेठ लालभाई वीकमलाल.
शेठ दलपतसाई भगनभाई.	वडील सांकणचंद रतनचंद.

वडील हरीलाल संधाराम.

आ हरणास्त सर्वानुभते मंजुर थया आढ छेवटनी हरणास्त वेारा आम-
रचंद ज्ञानराजे एवी भतवणनी रव्वु करी हती ते—“सने १८८० भां थयेला
झावें पैकी जे के ठरावें सुधारा वयारा सावे आ वणत पसार करवामां आव्या
ते शिवायना आडीना ठरावें तेज प्रगांजे डायम ते एम समज्जुं.” आ
हरणास्त उपर दासोहर आपुशा एवलावाणांचे एवो सुधारा मुक्त्यो हतो

३३२

जैनधर्म प्रकाश-भास वर्धारो.

उ-“ तीव्रोना हडो लालाववाने अणे तेमग चालु वलीवटने आणे वलीवट कृ-
नार भ्रतिनिधिंचाने आपेक्षी सत्ता शिवयना ठाबने संघवे तेमग आपेक्षी सत्तामा
इल विडूद कर्थ थतुं छाय तो ते संघंधमां स्थानिक भ्रतिनिधिंचानुं मंहार
अेकव भगो लाई गहुमते या शर्वानुमाने के इसव करे तेनो वलीवट कृनार
भ्रतिनिधिंचाने अमत्त इवो.”

आ सुधाराने हडो गणां भूग दरभारत सुधारा आथे सर्वानुमते पसार
थध हुती.

लार खाद बहुरसगमथी पधारेला टेवीजेणो अमदावादना श्री संघ तस-
इथी वर्कीव हरीकाळ संधारामे आलार मान्यो हुतो. बहुरसगमथी पधा-
रेला टेवीजेणो तसइथी रा. कुंवरलु आणुद्दलुमे तेनो ज्वाल आप्यो हुतो
अने करेला सत्तार संघंधी अमदावादना श्री संघने आलार मान्यो हुतो. तेने
वडोहरा निवासी उवेरी लालबाई कव्याणुमाई एडो आप्यो हुतो. लास-
खाद कवि सांकणथांहे आत्य मंगण वांच्यु हुतुं.

श्री संघ परिपदनुं अंत्य मंगण.

राग भारंग-मन भाने नाही रेण देस अमनवुं ताय शुं थाय-ओ याद
आज आनंद सधो, जैन श्वेताम्बर संघ भजो जयकारी;
निराधार थधो, स्थिर्गिरि ऐही प्रमुङ्घ परम सुभकारी. १३.

आज आनंद अमृत घन तुड्या, आज जिनशासन हेवा तुड्या,
आज ठेश फुक्याप पड्या लुंडी. आग्न० १

आज कस्तुरबाई नगरस्तोडी, पक प्रमुण ठिपावुं अठ निहे,

परिभण पसर्ही कस्तुरी घेडी. आग्न० २

आज लारतवर्पना संधे भणी, आयंद कव्याणुनी घेडी लदी,
श्री राजनगरमां स्थाप्त ठरी. आग्न० ३

स्थानिक ने वलीवटदार तणी, भ्रतिनिधिंचानी निमलुक लणी,

शुल ठाव पास ठर्यो पलाणी. आग्न० ४

वणी गहुविध सुधारा ठीधा, नों चांधे भत तेगां तीधा,

भानु अमृत रस घाला गीधा. आग्न० ५

जिनशन यस्तुकज आनंहे, लक्षितासर लविक भ्रमर वांहे,

श्री संघने सांकणरांह वहे. आग्न० ६

Fig. 4.

333

ત્યાર બાદ જવેરી કદ્વાણુંચંહ સોલાગચ્છે પ્રમુખ સાહેણનો આભાર માનવાની દરમાસ્ત કરી હતી. પ્રમુખ નગરશૈઠ કસ્તુરભાઈએ તેનો જવાબ આપ્યો હતો, અને ગોવાનું ડેવટનું લાખથિ વાંચી જાણાન્યું હતું. ત્યારણાદ પ્રમુખ સાહેણનો જવેરી કદ્વાણુંચંહ સોલાગચ્છે હુષ્પદાર ઘેરાવ્યો હતો એને ઘણું આનંદ સાથે મેળવણે ધર્માસ્ત કરવામાં આવ્યો હતો.

આ ચેળાવડામાં કયાં કયાંના ટેટલા ટેટલા ગૃહસ્થો પદાર્થો હતા તેનું લીટ અને પસાર થયેલા હરાયો, તે ડરાયો સુકનાર ને એકો આપનાર ગૃહસ્થનાં નામો અને સ્થાનિક પ્રતિનિધિઓનાં ગમોનાં લીટ વિશેરે હુએ પછીના અંકમાં આપવામાં આવશે.

ਪ੍ਰਮਾਤਮਾ ਸ਼੍ਰੀ ਸਾਧਨੁ ਕਲਿਆਣੁ ਕਰੋ।

विजय.

તમને કોઈ યાહ કરે નહિ અથવા વિસારી મૂકે અને જાણી જોઈને તમારી કોઈ દરડાર કરે નહિ છતાં તમે યુશ મિલજામાં રહો અને જગેલા અપમાનને માટે મનમાં આનંદ માસે તેજ ધરો વિજય છો.

तमाङ् करेलुं साङ् होय तो अण् युहुं लेखाय, तमारी धन्या विडूळ वर्तन थाय, तगां मन वारंवार हुःथाय तेवुं थाय, तमारी आपेक्षी शिखामणुनी हांसी थाय थांत तमे ते धीरजथी अने प्रेमथी उहारता राणी अगी णांच्या तेज अशेविन्यु छे.

આદા પેશાકથી, સાદા જોશાકથી, કોઈ પણ રતુથી, જેમે તેવા એકાંતવાનથી અને જેમે તેવી અલગાંગે આવે તેપણું ચાંદીય રખણવે નેજી ઘરે વિજય છે.

(तमारे लीये उत्पन्न थयो न होय तेयो पाण) गमे तेयो क्लेश, कंटाणा अने अनियन्त्रितपाण तगो आनंदही अहन दरी थडो तो ते अदो विनय छे.

મૂળીધ, ઉડિપણું, ધાર્મિક જ્ઞાનની આણસમજ અને કોકોની જોઈ વિદ્યા-
દ્વારા તે સર્વ અખા રહ્યા તેજ અથી વિજય છે.

વાતો કરવામાં ચેતાને માટે કંઈ પણ ઈસારો કરી કરવો નહિ, ચેતાના વખતાણ કરવવા નહિ, કરતાણ્ય ત્યારે મનમાં ચેટો આનંદ માનવો નહિ, અને હોકેમાં ઈર્જિ પણ રેકે ન પણ રે તેની દરકાર કરવી નહિ તેજ ઘરો વિનન્દ હે.

(આંગ્રેજી ઉપરથી.) N. G.

३७८

श्री शिवलाल ज्ञानरचना द्वारा ऐदकारक मृत्यु.

अहं रांधरभूर निवासी कैनशम्भु गणुज धर्मिष्ट, प्रकृतिए उदार, स्वस्त्रवे
शांत, साधु साध्योनी लक्षितमां तत्पर, भग्नालिक अने परेऽपकारशील हुता. संसारथी
गणुया विरक्त वृत्तिवाणा हुता. तेच्छा मात्र ३६ वर्षनी युवान वयमां वृद्ध मातुश्री,
विवाहीत एक पुनी अने अनाथ विधवाने तत्त्व हठमें क्षयना हुए व्याधिनो लोग
थह पड़ा छे. गया कर्तिक वहि १४शे रांधरभूर घासे तेच्छाये देह तनये छे.
छेवट सुधी घणु सारी शुद्धिमां अने धर्मपश्यालु वृत्तिमां रह्या छे. पाछला वर्ष
तमां स्थिति सामान्य छतां स्वालानिक शुण्डे क्रेवा ने तेवा अन्या रह्या हुता. अवा
सद्गुणी सलासद्वाना अलाव थवाथी अभारी सलांयो एक उत्तम व्यक्ति ओहां
छे. परंतु भावी अणवान छे तेनी पासे भनुष्य निदृपाय छे. तेथी अगे तेमनी
मातुश्री विजेत्रने दिलासा आपीचे छीचे अने तेमना आत्माने थांति इच्छीचे छीचे.

शा. वर्धमान चतुर्भुजनु ऐदकारक भरण.

श्री राणुभूर निवासी वर्धमान मारक्षीयां के वेच्छा सारा धर्मिष्ट, उदार
दिलना, जैनवर्गमां बद्धीता अने राणुभूरना संघर्षमां एक आणेवान गण्याता गृहुत्य
हुता; तेच्छा पोतानी ४९ वर्षनी वये गया माणशार शुहि १०मे पंचतत्व पास्या
छे. शोच्येनो स्वस्त्रव धूणो भायागु झो, मुनिसरजनी लक्षितमां तत्पर रहेता हुता
अने धर्मक्रियमां आणेवानी भर्ती लोग लेता हुता. तेच्छा मात्र सहजना व्याधिमां
मुंगाई पासे घाटकुपर घासे हेठमुक्त थया छे. पाछण संततीमां तेमना पुन
दृतीवाल यश थला लायक छे. तेमना डुटुंगने पडेवा असह हाण्यमां अमे
दिलासा आपीचे छीचे. वर्धमानबाई गणु विचक्षणु हेवाथी पोतानी पाछज शेक
संताप कमी डरवा संभांधी तेमन धर्मकर्त्त्व विशेष दरवा संभांधी पोते ज लग्नी
गया छे. काणानी गति हुस्तिक्का छे, तेनी पासे भनुष्य निदृपाय छे तेथी हुये
तेमना पुत्रे तेमना पगसे आवी श्री चंद्रमां पठेवी आमी जलाला न हेवी अज
कर्तव्य छे. अच्छा अग्नारी सलाना लाईकू भेस्यर हुता, तेथी सलाने पखु तेमनी
णानी पढी छे. परंतु भावी प्रणाल छे. असे तेमना आत्माने थांति भगे अम
इच्छीचे छीचे.

४

શોક ગોકળમાર્ઘ મુળચુંદ જૈન હોસ્પિટ મુલાઈનું પરિણામ.

શાદરહુ હોકાલગા અસ્થાસા કદન રા વિદ્યાર્થીઓનું સને રેલ્વેના પરીક્ષાનું
પરિણામ નાચે પ્રમાણે ચાંચું છે.

પરીક્ષા	એડલા વિદ્યાર્થી.	પાસ થયેલા.	રીમાર્ક
પહેલી ઓલ. ઓલ. પી.	૧	૧	
દૂસ્તી પી. એ.	૨	૨	૧ સેકન્ડ કલાસ.
ઇન્ટર ગીડીએટ.	૬	૪	૧ સેકન્ડ કલાસ.
પ્રોનીયસ.	૨૩	૧૫	૩ સેકન્ડ કલાસ.
મેટોક્યુલેશન.	૩	૨	
દૂસ્તી નેત. એગ. એન્ડ ઓસ.	૭	૦	
એગ. પી. એ. એસ. પુહેલુ વર્પ.	૨	૨	
<hr style="border-top: 1px solid black;"/>		<hr style="border-top: 1px solid black;"/>	<hr style="border-top: 1px solid black;"/>
	૩૮	૨૧	

યુનિવર્સિટીની પરીક્ષાનું પરિણામ ઉપર પ્રગાઢું ૬૬ ટકા છે. શિવાય નીજથી
છુટ્ટુ ધોરણ સુધીના એડર્ડેઝ હન્તાંતે નાધારતગામ વિષયગામ પાસ થયા છે.

ભાવનગર જૈન બોર્ડિંગનું પરીક્ષાનું પરિણામ.

પરીક્ષા.	એડલા વિદ્યાર્થી.	પાસ થયેલ	રીમાર્ક
પી. એ. છદ્દી	૧	૧	દૂસ્તી થયેલ છે
પ્રોનીયસ.	૬	૫	૧ સેકન્ડ કલાસ.
મેટોક.	૬	૫	૧ હાઇસ્કુલ સ્કોલરશીપ

આ શિવાય ચોથા પાંચમા ને છુટ્ટુ ધોરણું વિદ્યાર્થીઓ જોડા હતા તેમાં
૭ પાસ થયા છે. યુનિવર્સિટીની પરીક્ષાનું પરિણામ ૧૩ ગાં ૧૧ નું ડોવાથી ધણું
સંતોષકારક ચાંચું છે. એ એડર્ડેઝ કલાસવાળાને ઉમર વર્પ ૧૬ કરતાં એની ડોવાથી
ક્રમ ગણયું નથી.

આ શિવાય સિદ્ધશૈવ જૈનગામાંથી વિદ્યાર્થીઓ આ બોર્ડિંગાં રહે
છે, તેઓની વીજા, ચોથા ને પાંચમા ધોરણું પાંચ પરીક્ષા આપવા જોડા હતા
તેમાં ઉ પાસ થયા છે.

એકંદર ૩૧ બોર્ડરેને આ બોર્ડિંગને આ વર્ષગામ લાગ લીધે છે.

છપાઈને ભાડાર, પટેલ છે અસેયરતનકોષ.

શ્રી બંદ્રમનનું દિને રહેલો આ ગણો પણ વગ્ના ડાયોળી સ્વાસ્થો જીથે હો, બાવળાર બેન્ચની ક્રાન્ક જંબરમાટ બાધાનુંદી અધિર્વિક કાદિયાંની આગારી હાન્ડ્સની છપાઈને પણ ર પાઠવાનો આંદોલે, ન્યાયના ગાન્ધીયાંની સુનિ ગંધીનાની મનુષ્યતા મુસ્તક બાંદરા ઘણે લેટ આપવાનો છે, ખુદના આકારે જ્યાંની આગારીની અભિનૈત્ય હો, ચાન્દ જ્યાંથી માટે ડિગ્ન ગાત્ર ચાર આગો રાંગેલ છે, પોંટેજ નેટ ગાત્રો લાગે છે, માંગવાના ઉંઘાડ પણ કાણી ગંગાની દેખો,

છપાઈને ભાડાર પટેલ છે.

કર્મચાર્ય દીકા વિભાગ ર. એ.

(પાંચમો છે : કર્મચાર્ય દીકા વિભાગને ચાંકુત ચાર કર્મચાર્ય મૂળ.)

આ પીલે વિભાગ પણ શેડ સ્તરનું વારનું અને છુંબલુંગાઈ કેંચાંની અધિક સહાયથીન બાદાર પાઠવાનો આંદોલે, આંદોલ ડાયોળીની છે. ચાંકુતના આસ્થાની કાંચુ ચાંદીઓને તેમજ મુસ્તક બાંદર ઘણે લેટ આપવાનો છે, અન્ય કેંચાંના માટે ડિગ્ન ગાત્ર રૂ. ૨) રાખી છે. પોંટેજ ચાર આગો લાગે છે, તે ગાત્રાવાના ઈંચાડ સુનિશ્ચ વિગેરણ આગારી ઉપર લખતું.

અન્ધેર ખાડર.

સંદે કેનેન પાંદુલો-જાશુયવાનાં આંદોલાં પૂર્ણ ડેન્ફરન્સ વળને જેમણે કેંચાંનીએ તર્ફાં કાગ રૈંગ છે તેઓને જાંકીનાસના શેડ નથમણું ચુંબેલા (જાંકી ડેન્ફરન્સના મધુષ) રાંધીની ઇંધાનો ચાહ આપવાનું નક્કી થતો બાદાર આગારાના લાંબા તુંગઠના વધુંડ વોલટીયારોને ચાહ આંગી દેવાગ આવેલ છે. પણ ડેન્ફર પાંદુલાંની ખાંચ નર્દી હુંબાથી ણાડીનાં ચાહ આપવાનું બાંની કાંચુનું લથી નો કે પાંદુલે પૂનામાં વોલટીયારતું કાગ ડયુ હોય ગાને ચાહ ન જાયો હુંબ તેમણે તરત નીચેના દિરનાંથે ખત્રન્યવહાર કરી ચાહ મંગાવી લેલો.

ડેન્ફરન્સ આસ્ટ્રેલિયા.
પાંદુલાંની સુંખર્ડ નં. ૩

આસ્ટ્રેલિયા રેકેટરી.

શ્રી કેનેન અતાંગર ડેન્ફરન્સ.

નંદા મેમારોના નામ.

શેડ પેંગટવાલ સવચાંદ.	દીજેસ.	અંધેર વળનાં મેમાર.
દોરી પોંટેજવાલ તલકરી.	"	"
દાન પોંટેજવાલ પોંટેજવાલ.	પોંટેજ.	"
કો. કેંચાંન હાયાંડાં	સુરત.	"